



શ્રીલંકામાં લોહિયાળ દેખાવો:  
દેખો ત્યાં ઠારના આદેશ

PAGE NO. 19

# સ્વદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

**FOR BUYING, SELLING & LEASING**  
Investment In Real Estate Can Make Your Future Better...

**FOR SELLERS**  
Free Home Staging Consultation  
Professional Photography & Virtual Tour  
Attractive Advertising  
Social Media Marketing  
Customized Feature Sheet  
Weekly Open House  
Assist in Mortgage & Legal Services

**FOR BUYERS**  
Team of Strong Mortgage Brokers  
Team of Lawyers  
Professional Home Inspectors  
Step by Step Guidance Through out Buying Process

**AMIT SHAH**  
Sales Representative  
Dir: 647-995-5640  
amit@shahrealty.com

**KOMAL SHAH**  
Sales Representative  
Dir: 647-624-5640  
komal@shahrealty.com

Homekey236@gmail.com  
Web: www.amitshah.ca

FRIDAY, 13 MAY, 2022 Vol. 19, No. 19 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

## ભારતીય શેરબજારમાં મંદીનું ગ્રહણ : સેન્સેક્સમાં 1158 પોઈન્ટ કડાકો રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ધોવાયા

બીએસઈ 500ના 80 ટકા શેર મંદીમાં, 40 કંપનીના શેરમાં રોકાણકારોની સંપત્તિ અડધી થઈ, નિફ્ટીમાં 360 પોઈન્ટનો ઘટાડો

મુંબઈ

ગુરુવારે સતત પાંચમા દિવસે ભારતીય બજારમાં કડાકો નોંધાયો હતો. લાર્જ કેપ હોય કે સ્મોલ કેપ, તેઓ મંદીમાંથી બહાર આવવાનું નામ નથી લઈ રહ્યા. બીએસઈ 500ના લગભગ 80 ટકા શેર મંદીની પકડમાં છે. લગભગ 40 કંપનીઓના શેરમાં રોકાણકારોની સંપત્તિ અડધી થઈ ગઈ છે. બજારમાં વેચવાલીનું જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે. મુખ્ય સૂચકાંકો તેમની પર-સમાહની ઊંચી સપાટી કરતાં 13 ટકા વધુ ઘટ્યા છે. જ્યારે સ્મોલ કેપ્સ અને મિડ કેપ્સ 20 ટકાથી વધુ ડાઉન છે. હાલમાં દર પાંચમાંથી ચાર શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારના કારોબારમાં રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ રીતે, 11 એપ્રિલના ઉચ્ચ સ્તરથી, બજારમાં રોકાણકારોના લગભગ 38 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.



નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. મોટાભાગના એશિયન બજારો લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. વિદેશી રોકાણકારોની વાત કરીએ તો બુધવારે એફપીઆઈએ સ્થાનિક શેરોમાંથી રૂ. 3,500 કરોડની ચોખ્ખો ઉપાડ કર્યો હતો. હવે બધાની નજર ભારતના એપ્રિલ સીપીઆઈ ડેટા પર છે. અહીં પણ મોંઘવારી વધવાની ધારણા છે. BSE સેન્સેક્સ ગુરુવારે 2,18 ટકા અથવા 11,58 પોઈન્ટ ઘટીને 2,18,430 પર બંધ થયો હતો. ગુરુવારે સવારે સેન્સેક્સ 800 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 2,18,400 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે મહત્તમ 2,18,432 પોઈન્ટ અને ન્યૂનતમ 2,18,300 પોઈન્ટ સુધી ગયો. બજારના બંધ સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી, ફક્ત બે શેરો લીલા નિશાન પર હતા અને બાકીના લાલ નિશાન પર હતા. નિફ્ટી પણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

## શ્રીલંકામાં આર્થિક સંકટ દૂર થવાની આશા, રાનિલ વિક્રમસિંઘ નવા PM

કોલંબો

શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. 33 વર્ષીય યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતાએ બુધવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે વાતચીત કરી હતી અને તેઓ ગુરુવારે ફરી મળ્યા હતા. યુએનપીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે (સ્થાનિક સમય) વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ રાજપક્ષે વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. વિક્રમસિંઘે ચાર વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2019માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના દ્વારા તેમને વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, બે મહિના પછી સિરીસેના દ્વારા તેમને ફરીથી વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પાસે વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે કોસ પાર્ટી છે જે છ મહિના સુધી ચાલે છે.

## શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા, સાથીઓને દેશ નહીં છોડવા આદેશ

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે અને તેમના સાથીદારોને દેશ નહીં છોડવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. રાજપક્ષેએ પીએમ તરીકે રાજીનામું આપ્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી. મહિન્દા રાજપક્ષે ભારત ભાગી ગયા હોવાની અફવા પણ ઉઠી હતી.

સંસદમાં બહુમતી દર્શાવવા માટે વિક્રમસિંઘે સમર્થન દર્શાવ્યું છે. યુએનપીના પ્રમુખ વજીરા અભયવર્દનેએ કહ્યું છે કે વિક્રમસિંઘે નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી સંસદમાં બહુમતી મેળવી શકશે અને સોમવારે રાજીનામું આપનાર મહિન્દા રાજપક્ષેનું સ્થાન લેશે. ગત ચૂંટણીમાં તેમની પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી. યુએનપી દેશની સૌથી જૂની પાર્ટી છે.

કોરોનાથી ચીન બેહાલ:  
શાંઘાઈ-બેઈજિંગમાં  
દૈનિકીય સ્થિતિ

PAGE NO. 18

**ABOWATH**  
REAL ESTATE GROUP

MAAZ ABOWATH  
BROKER  
416 893 4585

More info on PAGE 2  
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

**SUPER VISA & INSURANCE**

Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply... Ask NOW for a free quote..

Sanjiv Puri  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

StarLife  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Need mortgage financing?  
Look no further. Let me make it happen.

RBC Royal Bank

**BHAVIN PATEL**  
Mobile Mortgage Specialist  
Royal Bank of Canada

bhavin.patel@rbc.com  
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069

Serving Greater Toronto Region Fax: 416-253-9461

**CIBC**

Mortgage advice  
that comes to you

For expert advice  
contact me today

**Dhires Shah**  
Mobile Mortgage Advisor

Tel : 647-248-0246  
dhires.shah@cibc.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896** અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**

Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential  
✓ New Condos  
✓ Investments  
✓ Commercial

દુરામાં રાદે સમજો

**Zakir Patel**  
Broker

Cell: 416-561-7973  
Office : 416-287-2222

RE/MAX  
COMMUNITY  
Realty Inc., Brokerage

Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email : patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

# લિબરલ ઉમેદવાર સામે બીભત્સ લખાણવાળા પોસ્ટર દર્શાવાયા

તિરસ્કારપૂર્ણ ભાષાનો ઉપયોગ કરનારા દેશને શું સંદેશ આપવા માંગે છે, સવાલ ઉઠાવી સાંસદે વ્યક્ત કરી નારાજગી

## ઓન્ટેરિયો

લિબરલ પાર્ટીનાં એક ઉમેદવારે જણાવ્યું હતું કે, ચૂંટણીનાં પ્રચાર દરમિયાન તિરસ્કારયુક્ત ભાષા અને ગુંડાગદીનાં દેશ્યો જોવા મળ્યા છે. રવિવારે સ્કારબોરોના ગિલ્ડવુડ ખાતે લિબરલનાં ઉમેદવાર મિઝી હન્ટરને ચૂંટણી સાહિત્યમાં અપમાનજનક ભાષા અને પ્રચાર દરમિયાન ગુંડાગદીનો અનુભવ થયો હતો.

મિઝીને એલ્ગામેર અને મારખમ રોડ ખાતે ખરાબ અનુભવ થયો હતો.

તેણે મીડિયાને જણાવ્યું હતું કે, મારી ચૂંટણી પ્રચારની ટીમને રવિવારના દિવસે વસતીવાળા દિવસોમાં બિભત્સ અને ગુંડાગીરી દર્શાવતાં પોસ્ટરો જોવા મળ્યા હતા. આવા 16 પોસ્ટરોમાં તિરસ્કારપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હન્ટરે કહ્યું



હતું કે, હું 16 વર્ષથી આ વિસ્તારના સાંસદ તરીકે કામ કરું છું, પરંતુ આવું મેં ક્યારેય જોયું નથી. આ ખરેખર નિરાશાજનક અને

અસ્વીકાર્ય બાબત છે. આવા પોસ્ટરો અને તિરસ્કારપૂર્ણ ભાષાના ઉપયોગ કરનારાઓ દેશને શું સંદેશ આપવા માંગે છે? સમાજમાં આજકાલ આવા બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે, જે ખરેખર ચિંતાજનક છે.

એલેન લેકોસે તેના ભાઈ સાથે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આવા તિરસ્કારપૂર્ણ અને ગુંડાગીરી દર્શાવતા સૂત્રો એની નજરે પડ્યાં હતાં. તેણે કહ્યું હતું કે, વહેલી સવારનાં આવાં દેશ્યો જોવા મળે એ ખરેખર નિરાશાજનક છે. હું ટોરોન્ટોમાં આટલાં વર્ષોથી રહું છું. પરંતુ આવા બનાવો ક્યારેય જોવા મળ્યા નથી. તેણે કહ્યું હતું કે, આવા આશરે 25 સાઈનબોર્ડ મારી નજરે પડ્યા હતા. પીસી અને એનડીપી પક્ષો તરફથી આ પોસ્ટરો મૂકવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે.

## કેનેડામાં ઓમિક્રોન સબ વેરિયન્ટ્સ દ. આફ્રિકાથી આવ્યા હોવાનું તારણ

### ટોરોન્ટો

કોવિડ-19ના ઈન્ફેક્શનમાં જે વધારો થયો છે, તેનું મૂળ કારણ દક્ષિણ આફ્રિકામાંથી આવેલા બે નવા ઓમિક્રોન સબ વેરિઅન્ટ્સ છે. મીડિયાને એક ઈ-મેલ દ્વારા જાહેર આરોગ્ય એજન્સી કેનેડાના પ્રવક્તાએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, બીએ. 4ના 3 કેસ કેનેડામાં નોંધાયા છે અને એક કેસ બીએ.5 નવો નોંધાયો છે.

કેનેડાની સરકાર હવે સપ્તાઈથી રાજ્યનાં કોવિડ-19 સંબંધી નિયમો પર નજર રાખી રહી છે. રાજ્યના

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, બે નવા ઓમિક્રોન સબવેરિઅન્ટ્સ ચિંતા ઉપજાવે તેવી બાબત છે. તેને માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પબ્લિક હેલ્થ એજન્સી કેનેડાની સાથે રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાના નિષ્ણાંત વૈજ્ઞાનિકો સક્રિય મોનિટરીંગ અને મૂલ્યાંકન કરી રહ્યાં છે. બીએ.4 અને બીએ.5 સબ-લિનિયેજનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, એમ પીએચએસીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું. આ અગાઉ હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં પીઅરની સમીક્ષા કરવામાં આવી ન હતી.

## ઉત્તર આલ્બર્ટામાં પૂર, લોકોએ ઘર છોડ્યા

### ટોરોન્ટો

ઉત્તર આલ્બર્ટામાં ભારે પૂર આવવાને કારણે ત્યાંની ચેતેલ કમ્યુનિટીનાં સેંકડો લોકો પોતાનાં ઘરો છોડીને ઉંચા સ્થાનો પર ચાલ્યા ગયા હતા. તેઓને છેલ્લા કેટલાક મહિનાથી ભારે પૂરને કારણે પોતાનાં ઘર છોડી સલામત સ્થળોએ સ્થળાંતરિત થવાની ફરજ પડી છે. રવિવારે અને સોમવારે મળીને આશરે 1100થી વધુ ડેને થા ફર્સ્ટ નેશન કમ્યુનિટીનાં લોકો સૌસા ક્રિક ખાતે પૂરનાં પાણી ભરાતાં પોતાનાં ઘર છોડી ગયાં હતાં અને છેલ્લાં કેટલાંક દિવસોથી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. આહાનાસેએ મીડિયાને સોમવારે જણાવ્યું હતું કે, આ બાબત ગંભીર ચિંતા ઉપજાવે તેવી છે અને હું પ્રાર્થના કરું છું કે દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરી શકે અને દરેક પરિવાર અને તેનાં મિત્રો એકબીજાને મદદરૂપ બને.

જ્યાં સુધી આ આફતનો અંત ન આવે ત્યાં સુધી હિંમત



જાળવી રાખવી આવશ્યક છે. જે લોકો ઉંચા સ્થળો પર રહે છે તેઓ રસ્તા પરથી પાણી ઓસરતાં ઝડપથી પોતાનાં ઘરે જઈ શકશે. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે અને સમસ્યા સર્જાય છે. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જ્યારે વરસાદનું પ્રમાણ વધે છે ત્યારે સ્વાભાવિક રીતે અહીં પાણીની સપાટી વધે છે.

## ન્યૂઝ આઉટલેટ, ફેસબુક તેમજ ગુગલની આવકની વહેંચણી માટે ખરડો પસાર થયો

બિલ સી -18 નામથી ઓનલાઈન ન્યુઝ એક્ટ અંગેનો ખરડો સંસદમાં રજુ કરાયો

### ઓન્ટેરિયો

ભારતમાં ડિજિટલ સમાચાર પ્રકાશકો કેનેડામાં ડિજિટલ ન્યુઝ ઈન્ટર મિજીએટરીઝ જેવી કે, ગુગલની આવકની વહેંચણી માટે કેનેડામાં એક કાયદો ઘડવામાં આવતાં ઉત્સાહમાં આવી ગયાં છે. આ કાયદામાં ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ અને ઈન્ટર મિજીએટરીઝ ગુગલ અને ફેસબુકની કમાણીની વહેંચણી કરવાની પદ્ધતિ ઘડી કાઢવામાં આવી છે. ડિજિટલ ઈન્ટર મિજીએટરીઝ કે જે

તેનાં યુઝર્સના ડિજિટલ સ્પેસનો ઉપયોગ તેમનાં ગ્રાહકોને ઈન્ટરનેટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડે છે. ભારતે આજે એક નવું ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે, વિશ્વભરમાં સમાચાર પ્રકાશકો પર કઈ રીતે નિયંત્રણ મૂકી શકાય અને તેનો લાભ લઈ શકાય.

કેનેડામાં ઓનલાઈન ન્યુઝ એક્ટ સંસદમાં રજુ કરવામાં આવ્યો છે. આ બિલ સી-18નાં નામથી 5મી એપ્રિલનાં રોજ રજુ કરવામાં આવ્યો છે. તેમાં ડિજિટલ ન્યુઝ અને ઈન્ટર મિજીએટરીઝ પર કેનેડામાં તેની કમાણીની આવકની વહેંચણી કઈ રીતે કરવી તેની જોગવાઈ કરવામાં આવી છે.

આ કાયદામાં એક એવાં માળખાંની વ્યવસ્થા કરવાનો નિર્ણય કરાયો છે.

કથા, હવન, ગાયત્રી યજ્ઞ,  
વાસ્તુ પૂજન, શ્રાદ્ધશાંતિ,

જીટીએમાં દરેક જગ્યાએ  
અમો સેવા આપીએ છીએ.

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨



કાલસપ્તે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ,  
વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન,  
બેબી શાવર, જેવા કાર્યો માટે  
સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622

Cell: 416-258-2750

THINKING OF  
BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ્સની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY  
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR  
SALES REPRESENTATIVE

Call us TODAY for  
all of your Real Estate  
needs and get honest,  
reliable and  
professional Service  
you can count on.



MOHAMMAD  
ABOWATH  
SALES REPRESENTATIVE

MAAZ  
ABOWATH  
BROKER - TEAM LEADER

IBRAHIM  
ABOWATH  
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH  
REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX  
CROSSROADS REALTY INC.



Member of the Real Estate Board of Ontario (REBO)

#SellwithABOWATH  
your Local REALTOR

# જઘન્ય યુદ્ધ-અપરાધ માટે વ્લાદિમીર પુતિન જવાબદાર: ટુડો

ટુડોએ જેલેન્સ્કીની મુલાકાત લીધી: નાયબ વડાપ્રધાન ક્રિસ્ટીયા ફ્રીલેન્ડ અને વિદેશમંત્રી મેલેની જોલી પણ જોડાયા, વધુ સૈન્ય મદદની ખાતરી આપી

## ટોરોન્ટો

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ શનિવારે યુકેનની અચાનક મુલાકાત લઈ આશ્ચર્ય સર્જ્યું હતું. યુકેનમાં રશિયાની ઘુસણખોરી અને ભારે યુદ્ધનાં સમયે ટુડોએ વ્લાદિમીર જેલેન્સ્કીની મુલાકાત લઈને આ યુદ્ધમાં કેનેડા યુકેનનાં લોકોની સાથે છે અને તેમને બનતી બધી જ મદદ કરવા તૈયાર છે, એમ કહ્યું હતું.

એક સંયુક્ત નિવેદનમાં જેલેન્સ્કી અને ટુડોએ જણાવ્યું હતું કે, કેનેડા યુકેનને વધુ સૈનિકસહાય પૂરી પાડતું રહેશે, જેમાં ડ્રોન કેમેરા, સેટેલાઈટ ઈમેજરી, નાનાં શસ્ત્રો, દારૂગોળો તથા આર્થિક મદદનો સમાવેશ થાય છે. ટુડોએ એમ પણ કહ્યું હતું કે, કેનેડા યુકેનને ભારે આર્ટિલરી પણ મોકલશે.



કેનેડાએ રશિયાનાં 40 લોકો અને પાંચ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ટુડોએ જણાવ્યું હતું કે, જઘન્ય યુદ્ધ અપરાધ માટે રશિયાનાં રાષ્ટ્રપતિ

વ્લાદિમીર પુતિન જવાબદાર છે અને એ માટે તેમની વિરુદ્ધ તપાસ યોજવી જોઈએ અને યુકેનનાં લોકોને ન્યાય મળવો જોઈએ. એ માટે અમે જ કંઈ સહકાર



આપવો પડે તે આપવા માટે તૈયાર છીએ. આ સિવાય વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત 25 મિલિયન ડોલરની આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહિલાઓના અધિકારોનાં રક્ષણ માટેની પ્રવૃત્તિ ચલાવવાનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવશે. જી-7 દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી અને તેમણે રશિયા વિરુદ્ધ વધુ પ્રતિબંધો મૂકવા અને યુકેનને મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધ વ્યક્ત કરી હતી. ટુડોની સાથે નાયબ વડાપ્રધાન ક્રિસ્ટીયા ફ્રીલેન્ડ અને વિદેશમંત્રી મેલેની જોલી પણ જોડાયાં હતાં. તેઓ રવિવારે સવારે ત્યાં પહોંચ્યા હતા અને યુદ્ધના મારથી ખરેખર બની ગયેલાં કિવની મુલાકાત પણ લીધી હતી. કેનેડાનાં વડાપ્રધાન ટુડોએ કિવ ખાતે રાજદુતાવાસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તેના માટે યોજાયેલા ધ્વજવંદનનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

## સિનિયર્સ સમાજ ઓફ મીસીસાગાની મિટીંગ: નવા સભ્યોને આવકાર અપાયો



### મિસીસાગા

ગત તારીખ May-7-2022ને શનિવારે ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસાગાની મીટીંગ બપોરે 2 વાગ્યે Mississauga Valley કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી હતી.

આ તકે સંસ્થાના 2021/2022ના જુના તથા નવા બધા સભ્યો આવ્યા હતા. સૌપ્રથમ મહેન્દ્રભાઈએ પ્રાર્થના કરાવ્યા બાદ કાર્યક્રમની રૂપરેખા રેખાબેન ગોઠિયા અને કેલાશબેન દેસાઈએ રજૂ કરી હતી. પહેલા ઈલાબેન

દેવાનીએ બોલિવૂડ કસરત કરાવી હતી. જે બાદ સંસ્થાની આવનારી EC મિટિંગમાં ઉભા રહેનારા સભ્યો ઈલાબેન દેવાની, પંકજભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, અરવિંદા ઋસ્તોમજી, અશ્વિનભાઈ વોરાએ પોત-પોતાનો પરિચય આપ્યો હતો. નવા મેમ્બરોની પરિચય વિધિ થયા બાદ સભ્યોની વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. મધર્સ ડે નિમિત્તે સિનિયર માતાઓને Tulips પુષ્પની ભેટ વિજયાબેન તથા જયશ્રીબેન ભટ્ટે આપી હતી. બાદ ટી-બ્રેકનું આયોજન થયું હતું.

## હોલ્ટન ગુજરાતી સિનિયર્સ ગ્રુપનો જલસા કાર્યક્રમ, સંગીત સાથે ગીત-ભજનો ગૂંજ્યા

અનેક ગીતોની તાલ પર સભ્યો ગરબા પણ રમ્યા

### હોલ્ટન

ૐ શ્રી ગણેશાય નમઃ ના મંત્રોના ઉચ્ચારણ સાથે હોલ્ટન ગુજરાતી સીનીયર્સ ગ્રુપની વર્ષ “૨૦૨૨ની” પહેલી બસ યાત્રા અને ગુજરાતી જલાસાનો કાર્યક્રમ ગત શનિવારે 7મી મે 2022 રોજ યોજવામાં આવી હતી.

હસુબેન અને બિહારીભાઈ સ્થાનકીયાએ એક મીની બસની સગવડતા કરતા સિનિયર્સ મેમ્બર્સ “રેકસોલ પ્લાઝામાં એકત્ર થયા હતા. “રેકસોલ પ્લાઝા, મિલ્ટન” અને બીજી બસ “ હિંદુ હેરીટેજ સેન્ટર-મંદિર, મિસ્સીસાગાથી ઉપડી હતી. સૌ પ્રથમ સૌ “સેન્યુરી ગાર્ડન્સ રિક્રિએશન



સેન્ટર” બ્રામ્પ્ટન ખાતે મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં જયભાઈ તથા તેમના પત્ની નેહાબેને સૌ યાત્રીઓને આવકાર આપ્યો હતો. કલાકાર જીતેન્દ્રભાઈ જોષી અને બહેન હરિતાબેન દેવે, દેસાઈએ શ્રી ગણપતિ બાપાની સ્તુતિથી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ મા જગદમ્બાને વંદન કરી “માડી તારું કંકુ ખર્યું અને સુરજ ઉગ્યો”ની પ્રસ્તુતિ થતાં

શ્રોતાગણ ભાવવિભોર થઈ ગયો હતો. શ્રીજી પ્રભુનું નામ સ્મરણ “મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી “ના સુંદર ભજનથી, પધારેલા વૈષ્ણવોના મન જીતી લેવાયા હતા. જયભાઈ ભાવસારે ગાયક વૃંદને વાદ્ય વૃન્દનો પરિચય કરાવ્યો હતો. ઉપસ્થિત બહેન-ભાઈઓએ અમુક ગીતોના તાલ ઉપર, ઉભા થઈને ગરબાનો લડાવો પણ લીધો હતો.

## VYO કેનેડા દ્વારા પ્રજયાત્રા: પુષ્ટિમાર્ગીય પાઠ: ગીત, નૃત્ય અને ભજનની રમઝટ

ભાનુભાઈ મિસ્ત્રીએ તૈયાર કરેલું શ્રીમહાપ્રભુજીનું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું

### ઓન્ટેરિયો

ગત તા. તા ૬-૭-૮મેના રોજ VYO કેનેડાના પ્રમુખ પ્રવીણભાઈ કે. શાહે પ્રજયાત્રાનું આયોજન કર્યું હતું. રાજેશભાઈ શાહના સહકારથી આયોજિત આ યાત્રામાં પી.કે શાહ પુષ્ટિભજન ગ્રુપમાં નિયમિત હાજર રહેતા હોવાથી તેમને આ ગ્રુપમાંથી ૨૫-૩૦ સભ્યોને સમાવવા જણાવાયું હતું.

અમેરિકાથી પુષ્ટિ ભજનમાં સભ્યો જોડાયા હતા. જે બાદ પી.કે શાહ અને ગીતાબેને નિર્ધારિત કરેલા કાર્યક્રમ મુજબ તા. ૬/૫/૨૨ના રોજ સવારે લકઝરી બસમાં સભ્યો નીકળ્યા હતા. આખા રસ્તે પુષ્ટિમાર્ગીય પાઠ, ગીત, સંગીત, નૃત્ય અને ભજનનો આનંદ કરતા સૌ સભ્યો સાંજે વ્રજ પહોંચ્યા હતા. આ બસમાં બ્રામ્પ્ટન ઉપરાંત ઈટોબીકોક અને સ્કારબોરોના વૈષ્ણવો પણ જોડાયા હતા. સાંજે શ્રીયમુનાજીની આરતીનો



લાભ લઈ પ્રસાદી લઈ બધા છુટા પડ્યા હતા. જે બાદ તારીખ ૭મીએ સવારથી બપોર સુધી અન્ય મનોરથ જેવા કે શ્રી શ્રીરાજજીને દૂધ અભિષેક, પરિક્રમા, પૂજન અને મુખ્ય હવેલીમાં પલના અને રાજભોગ તેમજ ધજાજનામનો રથનો લાભ લીધો હતો. બપોર પછીના દરેક સમાના દર્શનનો લાભ લીધા બાદ બધા

સભ્યો નવરત્ન હોલ તરફ પહોંચી ગયા હતા. જ્યાં શ્રીમહાપ્રભુજી અંગે અનેક પર્ફોર્મન્સીસ અને કીર્તન પણ રજૂ થયા હતા. આ પ્રોગ્રામનું સુંદર એન્કરિંગ રોહિણીબેન વાયેડાએ કર્યું હતું. ટેકનિકલ સંચાલન દિલીપભાઈ પરીખે કર્યું હતું. ભાનુભાઈ મિસ્ત્રી દ્વારા ખાસ તૈયાર કરેલું શ્રીમહાપ્રભુજીનું ચિત્ર એક આકર્ષણ હતું.

## પાર્ક-બીચ ખાતે આલ્કોહોલની છૂટ અપાવવા કાઉન્સિલરની મથામણ

અગાઉ રજૂ થયેલી દરખાસ્તને અભ્યાસ હાથ ધરવાનો બાકી હોવાથી પડતી મુકાઈ હતી

### ટોરોન્ટો

ટોરોન્ટો ખાતે એક કાઉન્સિલરે એવું સૂચન કર્યું હતું કે, અહીંના રહેવાસીઓને પાર્ક અને બીચ પર આ ઊનાળા દરમિયાન આલ્કોહોલ પીવાની પ્રાયોગિક ધોરણે છૂટ આપવી જોઈએ. ટોરોન્ટોનાં સેન્ટ પોલ, વોર્ડ નં. 12નું પ્રતિનિધિત્વ કરી રહેલાં જોશ મેટલોવે જણાવ્યું હતું કે, બુધવારે કાઉન્સિલમાં સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી લોકોને પાર્ક અને બીચ ઉપર આલ્કોહોલ પીવાની છૂટ આપવી જોઈએ.

ટોરોન્ટોના નાગરિકો સલામત રીતે બહાર પણ આવા પીણાં પી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મંગળવારે મેટલોવે કહ્યું હતું કે, અનેક ટોરોન્ટિયનો પોતાનાં નિવાસસ્થાનનાં પાછળનાં ભાગમાં આલ્કોહોલયુક્ત પીણાંની મોજ માણતા હોય છે. પરંતુ બહાર તેઓ આવી મજા લઈ શકતા નથી. મને

ટોરોન્ટોનાં કેટલાંક નાગરિકોએ રજૂઆત કરી હતી કે, આલ્કોહોલયુક્ત પીણાં પાર્ક અને બીચ પર પી શકાય તે માટે વિચારણા થવી જોઈએ.

કેનેડાનાં અનેક શહેરોમાં આવી છૂટ અમલમાં છે, એટલું જ નહીં અન્ય દેશોમાં પણ આવી છૂટ આપવામાં આવે છે. આ સૂચન મુજબ ઠંડા પીણાંઓમાં આલ્કોહોલનું પ્રમાણ 15 ટકાથી વધુ ન હોવું જોઈએ અને પ્રાયોગિક ધોરણે શરૂ થઈ રહેલો આ પ્રોગ્રામ 21 મેથી 31 ઓક્ટોબર સુધી ચાલુ રાખવો જરૂરી છે. આ દરખાસ્ત કોવિડ-19ના મહારોગચાળાને લઈને પણ રજૂ કરવામાં આવી હતી અને ફરીથી આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મેટલોવે આ સૂચન કર્યું હતું. ગયા વર્ષનાં એપ્રિલ મહિનામાં રજૂ થયેલી આ દરખાસ્તનો ઈકોનોમિક અને કમ્યુનિટી ડેવલપમેન્ટ કમિટીએ વિરોધ કર્યો હતો. આ જ પ્રકારની દરખાસ્ત ફરીથી રજૂ કરવામાં આવતાં તેના પર અભ્યાસ હાથ ધરવો જરૂરી હોવાનું બહાનું આપી ફરી એક વાર મુલતવી રાખવામાં આવી હતી.

તંત્રી સ્થાનેથી

## રાજદ્રોહ : કેન્દ્રની મમત સામે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ

ભારતમાં રાજદ્રોહની કલમ મુદ્દે ચાલી રહેલા વિવાદનો કાયમી અંત આવે તેવા સંકેતો છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લઈને ફરમાન કર્યું છે કે, કેન્દ્ર સરકાર રાજદ્રોહની કલમની સમીક્ષા ના કરી લે ત્યાં સુધી રાજદ્રોહના તમામ કેસોમાં સુનાવણ સ્થગિત કરી દેવાશે. આઈપીસીની કલમ ૧૨૪ એ હેઠળ રાજદ્રોહનો ગુનો નોંધાય છે. સુપ્રીમ કોર્ટે આ કલમ હેઠળ નવી કોઈ એફઆઈઆર નહીં નોંધવા પણ આદેશ કરી દીધો છે. આ સાથે જેમની સામે રાજદ્રોહના કેસ છે તેમને જામીન આપવા પણ સુચના આપી છે.



તંત્રી - પ્રકાશક સ્વદેશ

સુપ્રીમ કોર્ટનું આ વલણ અપેક્ષિત જ છે. કારણ કે, સુપ્રીમ કોર્ટે પહેલાં પણ રાજદ્રોહની કલમ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જે તે સમયે કેન્દ્ર સરકારે રાજદ્રોહની કલમ નાબૂદ કરવી ના જોઈએ એવી દલીલ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે તેની સામે પણ વેધક સવાલ કર્યા હતા. ભારતમાં રાજદ્રોહની કલમ મુદ્દે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલે છે. આ કલમની કાયદેસરતાને પડકારતી ઢગલાબંધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ છે. લશ્કરના ભૂતપૂર્વ અધિકારી મેજર જનરલ એસ.જી. વોમ્બાટકેરેએ કરેલી અરજીમાં રાજદ્રોહના બધા કેસ રદ કરવા માગણી કરાઈ છે. મેજર જનરલ વોમ્બાટકેરેની દલીલ છે કે, રાજદ્રોહને લગતી ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને કચડી નાંખે છે અને વાણી સ્વાતંત્ર્ય પર બરાબ અસર કરે છે. આ કલમનો વ્યાપક દુરુપયોગ કરીને ખોટા કેસ કરીને નાગરિકોને જેલમાં ધકેલી દેવાય છે.

૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે આ અભિપ્રાય સાથે સંમતિ દર્શાવીને રાજદ્રોહની કલમને અયોગ્ય ગણાવી હતી. આ સમયે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે, દેશની આઝાદીની લડતને કચડી નાંખવા માટે બનાવાયેલી આ કલમ આઝાદીનાં ૭૩ વર્ષ પછી પણ કેમ અસ્તિત્વમાં છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અંગ્રેજો મહાત્મા ગાંધી સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના અવાજને દબાવી દેવા માટે રાજદ્રોહની કલમ લગાવતા હતા અને અત્યારે પણ સ્થિતિ બદલાઈ નથી. સુપ્રીમ કોર્ટે અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગીને કલમની બંધારણીય કાયદેસરતાની સમીક્ષા કરવાનું સ્વીકાર્યું હતું. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પોતે આ કલમની તરફેણમાં નથી. જો કે, મોદી સરકારનું વલણ રાજદ્રોહની કલમ નાબૂદ કરવાનું ન હતું. કેન્દ્ર વતી એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે ચોખ્ખા શબ્દોમાં આ કલમને ચાલુ રાખવાની તરફેણ કરી હતી. કેન્દ્ર સરકારે તમામ હવાતીયા મારી જોયા પરંતુ સુપ્રીમે મચક ન આપી. છેવટે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે કમને આ કલમની સમીક્ષા કરવાની તૈયારી બતાવવી પડી હતી.

સુપ્રીમ કોર્ટે આકરું વલણ લેવું પડ્યું તેનું કારણ રાજદ્રોહની કલમનો ભયંકર દુરુપયોગ છે. તેના માટે મોદી સરકાર પર દોષારોપણ કરાય છે. પણ વાસ્તવમાં ભારતમાં રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ બધા પક્ષોએ કર્યો છે. ભાજપની સરકાર દૂધે ધોયેલી નથી જ. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ કર્યો અને ૯ મહિના સુધી તેને જેલમાં ધકેલી દીધો હતો. આ ઉપરાંત પત્રકાર વિનોદ દુઆ સામે પણ રાજદ્રોહનો કેસ નોંધીને અભિવ્યક્તિની આઝાદી કચડવાનો પ્રયાસ સરકારે કર્યો છે. આવા અનેક કિસ્સા છે. જો કે આ ધંધો કોંગ્રેસ અને બીજા

પક્ષોની સરકારોએ પણ કર્યો જ છે. હાર્દિક સામેના રાજદ્રોહ કેસ મુદ્દે આભ માથે લેનારી કોંગ્રેસના અશોક ગેહલોત સરકારે ૨૦૨૦માં રાજસ્થાનમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.

મહત્વની વાત એ છે કે, હાર્દિક સામે રાજદ્રોહના કેસ પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ઢંઢેરામાં કોંગ્રેસે રાજદ્રોહની કલમ નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પોતે જ આ વચનને ઘોળીને પી ગઈ હતી. હમણાં મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની સરકારે પણ આ જ વલણ દાખવ્યું છે. સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા સામે હનુમાન ચાલીસા વિવાદમાં રાજદ્રોહનો કેસ નોંધી દેવાયો છે. સુપ્રીમ કોર્ટે ૧૯૬૨માં કેદારનાથ યાદવ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં રાજદ્રોહની કલમની કાયદેસરતા પર મંજૂરીની મહોર મારી હતી. ચીફ જસ્ટિસ રામનાની બેંચ એ ભૂલ સુધારવાના મૂડમાં છે. સુપ્રીમ કોર્ટના ફરમાનને કારણે હજારોની જામીનમુક્તિ માર્ગ મોકળો બન્યો છે. સત્તાવાર આંકડા પ્રમાણે જ ૨૦૧૦ પછી ૧૦,૯૩૮ લોકો સામે રાજદ્રોહના ૮૦૬ કેસ નોંધાયા છે. આ પૈકી જે પણ જેલમાં છે એ બધાને જામીન મળી જશે. ભારતમાં ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન રાજદ્રોહના કેસોમાં બિહાર ૧૬૮ કેસો સાથે પહેલા નંબરે છે જ્યારે ૧૩૫ કેસો સાથે તમિલનાડુ બીજા સ્થાને છે. ઉત્તર પ્રદેશ ૧૧૫ કેસ સાથે ત્રીજા, ઝારખંડ ૬૨ કેસ સાથે ચોથા અને કર્ણાટક ૫૦ કેસ સાથે પાંચમા સ્થાને છે. ભાજપ રાજદ્રોહની કલમનો ઉપયોગ પોતાની સામે ઉઠતા અવાજને દબાવી દેવા માટે કરે છે એવા આક્ષેપ થાય છે તેનું કારણ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સામે ટીકાત્મક કે અપમાનજનક ટીપ્પણી બદલ થયેલા રાજદ્રોહના કેસ છે. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી મોદી સામે ટીપ્પણી કરવા બદલ ૧૪૮ લોકો સામે જ્યારે યોગીની ટીકા બદલ ૧૪૪ લોકો સામે રાજદ્રોહના કેસ નોંધાયા છે. મતલબ કે મોદી અને યોગીની ટીકા કરવા બદલ ૨૮૩ લોકો સામે રાજદ્રોહનો કેસ થયો છે. આ કેસ યોગ્ય રીતે કરાયા છે કે નહીં એ ચકાસવાનું કામ કોર્ટનું છે તેથી તેના વિશે ટીપ્પણ કરવી યોગ્ય નથી પણ કોઈ નેતાની ટીકા બદલ રાજદ્રોહના આટલા બધા કેસ થાય એવું ભારતમાં પહેલી વાર બન્યું છે. ખેર વાત હવે અટકી જશે તેવા સંકેતો છે.

કારણ કે, સુપ્રીમના ફરમાનને પગલે આ બધા કેસો હાલ પૂરતા અભરાર્થ પર ચડી ગયા છે. રાજકારણીઓ રાજદ્રોહની કલમનો દુરુપયોગ કરે છે તેનો પુરાવો રાજદ્રોહના કેસોમાં દોષિત ઠરવાનો રેશિયો છે. ૨૦૧૪થી ૨૦૨૦ સુધીમાં દેશભરમાં રાજદ્રોહના ૩૮૮ કેસ નોંધાયા તેમાંથી ૧૬૮ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ અને ૬૬ કેસમાં સુનાવણી પણ પૂરી થઈ ગઈ પણ માત્ર ૮ કેસને સજા થઈ છે. મતલબ કે અઢી ટકાથી પણ ઓછા કેસમાં સજા થઈ છે. બાકીના ૮૮ ટકા કેસોમાં સજા નથી થઈ, તેનો અર્થ સ્પષ્ટ છે કે, આ કેસો ખોટા કરાયા હતા.

મોદી સરકારની દલીલ હતી કે, કેટલાક કેસોમાં દુરુપયોગ થયો તેના કારણે કલમ નકામી છે એવું માની ના લેવાય. સુપ્રીમ કોર્ટના ગળે આ વાત ઉતરી નથી એ યોગ્ય થયું. રાજદ્રોહની કલમ હેઠળ જાહેર જનતાને ભડકાવવાની કોશિશ કરનાર કે હિંસા ભડકાવવાની કોશિશ કરનારને જેલભેગો કરી શકાય છે. એ માટે બીજી વધારે આકરી કલમો છે જ તેથી પણ રાજદ્રોહની કલમ જરૂરી નથી.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

**ARISTO PEST CONTROL**  
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



- ✓ Mice
- ✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



- ✓ Cockroach
- ✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



- ✓ Animal Control
- ✓ Bird Control
- ✓ WASPS and
- ✓ Hive Removal

**24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL**

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



**CALL SANKET TRIVEDI - 647.339.3926**  
Government Licensed Structural Exterminator



**DIVINE YOGA**



By Geeta

**Children Yoga Class**

Every Tuesday 5-6 PM

**Adult Yoga Class**

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :  
One to One Individual  
and Therapeutic

**Geeta Tailor**  
**416-456-2261**

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta



# પાટણમાં સિંગર કાજલ મહેરીયા પર હુમલો, સોનાની ચેઈન લૂંટી લેવાઈ

પાટણ

પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરીયા પર એટેક કરાયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી.

સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલા બાદ કાજલ મહેરીયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય 4 શખ્સો સામે હુમલાની ફરિયાદ કરી છે.

દિગડી ગામના રમુ દેસાઈએ કાજલ પર જૂની



અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ હુમલામા કાજલ મહેરીયાને ઈજા પહોંચી છે, તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે. વર્ષ 2020 માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરીયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં બનેલા આ બનાવમાં કાજલ મહેરીયાને લાફો ઝીંકાયો હતો. કાજલ મહેરીયા ઈવેન્ટ ઓર્ગનાઈઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા.

## REQUIRED

Part Time and Full Time Indian/  
Gujarati Cook Ladies for Kitchen  
Helper and Waitstaff

**AMAR CHAUHAN**

Cell 416-988-9518

India Grill House and Banquet  
16-2800, Markham, Ontario L3R 0E4  
(14th Ave and Woodbine).

# Imperial

PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :  
Our disinfectant services that we offer are:


**1 Spray Services** **2 Fogging Services** **3 Sanitation Services**

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs,  
Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.  
Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon,  
Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

# ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

## Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,  
છોલેપુરી, કટલેસ,  
ખાસ્તા ક્યોરી,  
સેવ ઉસળ, સમોસા ચાટ

## Takeout & Catering

Limited થાળી  
(with sweet & Farsan)  
**\$9.00 +Tax**

Limited થાળી  
(without sweet & Farsan)  
**\$7.50 +Tax**



## CATERING SPECIAL

**\$ 14.99** 10 items  
+Tax  
Sweet, Farsan, Subji,  
Kathor, Puri, Dal, Rice  
Papad, Pickle, Kachumber

Franchise  
Opportunity  
in GTA

Call us for details

રસોઈકામ  
કરી શકે તેવા  
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

# નડિયાદ ખાતે પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી જીંદગીનો અંત આણી દીધો

યુવતીને રિક્ષા ચાલક સાથે પ્રેમ થતા સમાજ નહીં સ્વીકારે તેવા ભયે આપઘાત કર્યો

નડિયાદ

નડિયાદ તાલુકાના અરેરામાં ઉર્વશીબેન ઉર્ફે પૂનમ જયંતીભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહેતી હતી. ઉર્વશીબેનના પિતાનું અવસાન થયેલ હોય તે તેની માતા તથા નાના બે ભાઈઓ સાથે રહેતી હતી. ઉર્વશીબેન નડિયાદ એલ.આઈ.સી. ઓફિસ નોકરી કરતી હતી. તે દરરોજ રિક્ષામાં અપડાઉન કરતી હોય મોટી સિલોડ ખાતે રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા નિર્મલભાઈ વિનુભાઈ સોલંકી



(ઉ.વ.૩૩) સાથે મિત્રતા થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. નિર્મલભાઈ પરિણીત હતા પરંતુ કોઈ કારણોસર છૂટાછેડા લીધા હતા. ઉર્વશીબેન

અને નિર્મલના પ્રેમ સંબંધને સમાજ સ્વીકારશે નહીં તેમ જાણી બંને પ્રેમી પંખીડાએ સવારના સમયે સીલોડ ગામના ફાટક નજીક રેલવે લાઈન ઉપર સાથ જીયેંગે સાથ મરેંગેના કોલ નિભાવવા કોઈપણ ટ્રેન નીચે ઝંપલાવી જીંદગીનો અંત આણ્યો હતો. દરમિયાન સાંજના સમયે રેલવે લાઈન નજીક કોઈ યુવક યુવતીના કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ જોતા સ્થાનિક રહીશોએ નડિયાદ રૂરલ પોલીસને જાણ કરી હતી.

# BOBને 343.63 કરોડ ચૂકવવા સાંડેસરા બંધુને DRTનો આદેશ

વડોદરા

સાંડેસરા બંધુઓ વિવિધ બેંકોના મળીને રૂ.૧૫૦૦૦ કરોડના બેંક કૌભાડના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી દેશ છોડીને ફરાર છે. દરમિયાનમાં ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી) એ તાજેતરમાં એક ચુકાદો આપીને બેંક ઓફ બરોડાના બાકી નીકળતા રૂ.૩૪૩.૬૩ કરોડ બે મહિનામાં ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.

ડીઆરટીની અમદાવાદ બેંચના પ્રિસાઈડિંગ ઓફિસરે રિકવરી સર્ટિફિકેટ સાથે ઓર્ડર ઈશ્યુ કર્યો છે જે મુજબ સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સ લિમિટેડ અને તેના બે ડાયરેક્ટરો નિતિન તથા

ચેતન સાંડેસરાએ બેંક ઓફ બરોડાના બાકી નીકળતા રૂ.૩૪૩.૬૩ કરોડ બે મહિનામાં ચૂકવી દેવા. આ આદેશ બેંક ઓફ બરોડાએ કરેલી અરજી બાદ આપવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડાએ સાંડેસરા બંધુઓની લોન વસૂલી માટે સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સની મિલકતો વેચીને લોનની વસૂલી માટે મંજૂર માગતી અરજી ડીઆરટીમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ ઈન્ટરનેશનલ, સ્ટર્લિંગ બાયોટેક અને સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સ જેવી કંપનીના માલિક એવા નિતિન અને ચેતન સાંડેસરા ઉપરાંત તેના પરિવારજનો ૨૦૧૭થી ફરાર છે.

# વડોદરામાં એક રાતમાં 15 સફળ પ્રસૂતિ કરાવનારી નર્સનું સન્માન થયું

વડોદરા

દાહોદ જિલ્લાના ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રની નર્સ સોનલબેન તેરસીંગ ડામોરે એક રાતમાં ૧૫ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. જેથી તા.૧૨ મી મે એ સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયના પ્રણેતા એવા ફ્લોરેન્સ નાઈટિંગલના જન્મ દિવસને ઈન્ટરનેશનલ નર્સિંગ ડે ઉજવણી દરમિયાન તેણીનું સન્માન કરાયું હતું. વડોદરા સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અને સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. સવારે નર્સિંગ કોલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વર્ષના સ્ટુડન્ટ્સનો શપથવિધિ સમારોહ પણ યોજાયો હતો.

# બોરસદના નાપામાં માથાભારે શપ્સની દાદાગીરી સામે વેપારીઓએ બંધ પાળ્યો

આણંદ

બોરસદ તાલુકાના નાપા ગામના માથાભારે લર્વીગખાન તથા તેના સાગરીતો દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં બે યુવકો ઉપર હુમલો કરવામાં આવતા ગ્રામજનો દ્વારા મંગળવારે રાત્રિના સુમારે પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી પોલીસ મથક નજીક ઘેરાવો કરવામાં આવ્યો હતો. બાદમાં બુધવારે ગ્રામજનોએ નાપા ગામમાં વેપાર-ધંધા બંધ રાખી સજ્જત વિરોધ નોંધાવ્યો હતો.

નાપા ગામના માથાભારે શપ્સ આલેફખાન ઉર્ફે લર્વીગખાન રસુલખાન પઠાણ તથા તેના સાગરિતો દ્વારા ત્રણ


દિવસ પૂર્વે ઉછીના પૈસા બાબતે ગામના જ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ પણ નોંધાઈ હતી. બાદમાં ગઈકાલ રાત્રિના સુમારે પણ મોટરસાયકલ ઉપર નાપા તરફ જઈ રહેલ સલીમમીયાં રીયાઝમીયાં કાજીને વાંસખિલિયા ગામ નજીક લર્વીગખાન પઠાણ તથા તેના સાગરિતોએ રોકીને માર માર્યો હતો. લઘુશંકા કરવા જતા પાછળથી એક નંબરપ્લેટ વગરની કારમાં આવી ચડેલ શપ્સોએ અર્શ મહંમદ સાથે ફરવાનું છોડી દેજે તેમ કહી ધાકધમકી આપી હતી.

# સોખડા ગુણાતીત સ્વામી આપઘાત કેસની તપાસ કાઈમ બ્રાંચને સોંપાઈ

વડોદરા

સોખડા હરિધામમાં ગુણાતીત સ્વામીના ચક્રચારી આપઘાત કેસની તપાસ ફરી બદલવામાં આવી છે. હવે આ કેસની તપાસ જિલ્લા કાઈમ બ્રાંચ કરશે. ઉલ્લેખનીય છે કે હરિધામમાં ગુણાતીત સ્વામીના મોતની ઘટના છુપાવવામાં આવી હતી જો કે બીજા દિવસે તેમના મોત અંગે શંકા વ્યક્ત કરાયા બાદ સયાજી હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું જેમાં ગુણાતીત સ્વામીના ગળા પર ફાંસાના નિશાન જણાતા તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં આ કેસની તપાસ તાલુકા પોલીસના એએસઆઈ કરતા હતા બાદમાં આ તપાસ સિનિયર પીએસઆઈને સોંપવામાં આવી હતી.



## UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH  
POSITIVE CASH FLOW

  
**ZIVASA**  
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu  
& Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana  
Broker

# પંચમહાલમાં ભાજપના જુગારી ધારાસભ્ય સહિત 26 લોકો દોષી જાહેર, 2 વર્ષની સજા

વડોદરા

1 જુલાઈ, 2021 ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ કુલ 26 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રૂપિયા રોકડા, 25 મોબાઈલ, લેપટોપ અને 8 લકઝુરિયસ કાર સહિત 1.15 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 સજા સમયે હાજર હતા. કોર્ટે કલમ 4 અનુસાર 2 વર્ષની સજા,



3 હજારનો દંડ, કલમ 5 અનુસાર 6 મહિનાની સજા ફટકારી હતી. આ ઉપરાંત 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આરોપીઓને સજા ફટકારી હતી. આ ઉપરાંત જીમીરા રિસોર્ટનો પરવાનો પણ રદ કરવા માટેનો આદેશ આપ્યો હતો. કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપની ટીકિટ પર ચૂંટાય પણ છે.

# પંચમહાલના કાલોલમાં મસ્જિદ પાસે વરઘોડા ઉપર પથ્થરમારો

પંચમહાલ

પંચમહાલના કાલોલ નગરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. કાલોલના ગઘેડી ફળિયામાંથી મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. મસ્જિદ પાસેથી મોડી રાત્રે વરઘોડો નીકળી રહ્યો હોવાને કારણે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેના બાદ મામલો બિચક્યો હતો.

આ બાદ વરઘોડા પર પથ્થરમારો કરાયો હતો. ડી.જે. સાથે નીકળેલા વરઘોડા પર પથ્થરમારો કરાતા રાત્રિ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહિ, મહોલ એટલો બગડ્યો હતો કે, વાહનો અને

દુકાનોની પણ તોડફોડ કરાઈ હતી. તે બીજી તરફ, તંગદીલીભર્યા માહોલમાં વરરાજાના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

મોડી રાત્રિની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માહોલ તંગ બનતા સમગ્ર જિલ્લાની પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે પથ્થરમારો કરનાર તત્વોને શોધી કાઢી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જે બાદ બંને પક્ષે સામ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

## વડોદરાનો પ્રથમ કિસ્સો : ડોક્ટરના અવસાન પછી તેમના ઓર્ગન ડોનેટ કરાયા

વડોદરા

શહેરના સિનિયર રેડિયોલોજિસ્ટને ત્રણ દિવસ અગાઉ ચક્કર આવતા તેઓ ઘરમાં દાદર પરથી નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજાના કારણે ડોક્ટરે તેઓને બ્રેનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારે તેઓના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. અને તેઓની બે કિડની અન્ય બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા દર્દીઓને નવજીવન મળ્યું હતું. રેસકોર્સ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડો.નરેન્દ્ર પરીખ (ઉ.વ.૬૭) ગત ગુરુવારે સાંજે ઘરમાં દાદર પરથી નીચે પડી જતા તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમના પત્ની ડો.દિવ્યાબેન વોર્કિંગ પરથી પરત ઘરે આવ્યા ત્યારે તેમણે ડો.નરેન્દ્ર પરીખને બેભાન હાલતમાં જોયા હતા.

## કનેરા પાસે ટેન્કરે 2 બાઈકને ટક્કર મારતાં 2 મહિલા સહિત ત્રણનાં મોત

ખેડા-અમદાવાદ હાઈવે પર અકસ્માત પછી ચાલક નાસી છુટ્યો

નડિયાદ

ખેડાના ભગુપુરા ગામમાં કનેરાલાલ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી પાયલ તેનાથી નાનો દીકરો અશોક, નાની દીકરી છાયા છે. અશોકના બે વર્ષ અગાઉ નીલમ સાથે થયા હતા. નીલમ તેના પિયર ગયેલ હોઈ તા ૮ મી અશોક પોતાના મિત્રની બાઈક લઈ તેની સાસરી વટવા ખાતે તેને લેવા માટે ગયો હતો. દરમિયાન સાંજના સાત વાગે અશોક પોતાની બાઈક પર પત્ની નીલમને બેસાડી બારેજાથી ખેડા તરફ પોતાના ઘરે

આવતો હતો. તેની સાથે ગામના સતિષભાઈ સોલંકી બાઈક લઈ કનેરા સીમમાંથી પસાર થતા હતા. તે વખતે રોંગ સાઈડે એક ટેન્કર પુરપાટ ઝડપે આવી બંને બાઈકને ટક્કર મારતા સતિષભાઈ, ભાવનાબેન સોલંકી તથા અશોક-નીલમ રોડ પર ફંગોળાઈ જતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા ભાવનાબેનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત થતાં આજુબાજુના લોકો આવી જતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નવજીવન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અશોક તથા નીલમને મૃત જાહેર કર્યા હતા.

## શાર્પશૂટર એન્થોનીને ભગાડવામાં મદદ કરનાર સત્રી મધ્યપ્રદેશથી પકડાયો

વડોદરા

સયાજીગંજની હોટલમાંથી ફરાર થઈ ગયેલા શાર્પશૂટર એન્થોનીની પાછળ છોટાઉદેપુરથી કારમાં આવેલા અને એન્થોની ભાગી જતાં કાર મૂકી ફરાર થઈ ગયેલા સત્રી પંચોલીને પોલીસે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. છોટાઉદેપુર ખાતેની સબજેલમાંથી વડોદરાની સિવિલ હોસ્પિટલમાં લવાયેલો ખૂંબાર ગુનેગાર અનિલ એન્થોનીને પીએસઆઈ જે પી ડામોર સયાજીગંજની પૂજા હોટલમાં પત્ની અને બહેનને મળવા માટે લઈ ગયા હતા. જ્યાં એન્થોનીએ અગાઉથી યોજેલા ષડયંત્ર મુજબ સોહેલ પીએસઆઈને જમવા માટે લઈ ગયો હતો અને એન્થોની ફરાર થયો હતો. આ ગુનામાં કાઈમ બ્રાન્ચના પીઆઈ જાડેજાના નેજા હેઠળ ટીમે 9 ને ઝડપી પાડ્યા છે.

**SHARP**  
INTERNATIONAL  
IMMIGRATION SERVICES

**CANADA**  
**IMMIGRATION**

**SPOUSAL SPONSORSHIP**  
**SPECIALIST (98 percent success ratio)**

**Last minute student admission**  
Please contact us on  
**416-745-2466 or 91-9428973911**

- Conestoga
- Seneca
- Humber
- Lambton
- Fanshawe
- Georgian
- Algoma
- Canadore
- Algoma polytechnic
- Mohawk

**ONLINE IELTS**  
**SPOKEN ENGLISH CLASSES**  
**ON ZOOM**

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /  
DETENTION REVIEWS /  
CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL  
APPLICATIONS

<b>CANADA</b>	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
<b>VADODARA</b>	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
<b>AHMEDABAD</b>	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

**: Specialized in :**

**Job Offer & LMIA**  
**Entrepreneur**  
**Investor Business**  
**Self Employed**  
**Farm Investor**

Email.: info@siis.ca / Website.: www.siis.ca

## વાલોડમાં પત્નીને સળગાવ્યા બાદ પતિએ બાથ ભીડી, દંપતીનું મોત

વાલોડ

વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં મંગળવારે બપોરે ૩.૩૦ કલાકે અરેરાટીભરી ઘટના બની હતી. કચેરીમાં મનરેગા શાખામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી કરાર આધારિત ઓપરેટર તરીકે કામ કરતા મહિલા કર્મચારી મયૂરિકા અનિલ પટેલ (ઉંમર આશરે ૪૦, રહે. ચાંપાવાડી, વ્યારા)ના લગ્ન ઉચ્છલમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પટેલ જોડે થયા હતા. અનિલભાઈ પટેલે અગાઉ પણ તાલુકા પંચાયત કચેરીમાં પહોંચી મયૂરિકાબેન સાથે શાબ્દિક બોલાચાલી કરી હતી. દરમિયાન મંગળવારે બપોરે ૩.૩૦ કલાકે તાલુકા પંચાયતમાં પહોંચ્યા બાદ અનિલ પટેલે મનરેગા શાખાની આસપાસની રૂમને બહારથી આગળો મારી દીધો હતો. આ સમયે મનરેગા ઓફિસમાં મયૂરિકા સાથે અન્ય કામ કરતા અન્ય કર્મચારી કામ અર્થે અન્ય ઓફિસમાં ગયા હતા. વધુમાં અનિલ મયૂરિકા પાસે પહોંચી તેણીના શરીર પર જ્વલનશીલ



પ્રવાહી છાંટી દેતા તેણીનું શરીર સળગી ગયું હતું. આ સાથે જ ચીસાચીસ સાથે લોબીમાં મદદ માટે મયૂરિકાએ દોડ લગાવી હતી. જો કે, આ સમયે અનિલે તેણીને અટકાવીને તેને બાઝી જઈ પોતે પણ સળગી ગયો હતો. ઘટનાને પગલે ભૂમાભૂમ થતા કચેરીનો સ્ટાફ ઉપરના માળે ધસી ગયો હતો, પરંતુ દંપતીને બચાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આખરે દંપતીએ તાલુકા પંચાયત કચેરીમાં જ દમ તોડ્યો હતો. આ ઘટનામાં અનેક સવાલો ઊઠ્યા હતા. અલબત્ત સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

## રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત

સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવનાર આમ આદમી પાર્ટીએ ગત ૧૧ માર્ચના રોજ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તે અંતર્ગત સીમાડા નાકા સ્થિત આપના કાર્યાલય આગળ લોકો રાષ્ટ્રધ્વજ લઈને ઉભા હતા. તે પૈકી મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬ ના મહિલા કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઈ કેવડીયાએ જ રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી લહેરાવ્યો હતો. તેના ફોટા અને વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ અંગે મૂળ અમરેલીના સાવરકુંડલાના નેસરી ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક કૃષ્ણકુંજ સોસાયટી ઘર નં.૩૧ માં રહેતા ૪૭ વર્ષીય વેપારી પ્રણવકુમાર મગનભાઈ પટેલે કરેલી અરજીના આધારે સરથાણા પોલીસે ગત મોડીરાત્રે શોભનાબેન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધ્યો હતો.

## પાલ કોટન મંડળી સાથે ઠગાઈનો ગુનો: ભૂતપૂર્વ ચેરમેનની ધરપકડ

સુરત

સુરતના જહાંગીરપુરાની પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનું ડાંગર ખરીદ્યા બાદ બાકી નિકળતી રકમ રૂ.૨૭.૭૭ કરોડ ચૂકવવા માટે વાયદા કરનાર મંડળીના ભૂતપૂર્વ ચેરમેન અને નવસારી સુપાના પૌઆ મિલના માલિક દંપતિ વિરુદ્ધ કાર્ડમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ગતરોજ મંડળીના ભૂતપૂર્વ ચેરમેન અને પૌઆ મિલના મહિલા માલિક આગોતરા જામીન સાથે હાજર થતા કાર્ડમ બ્રાન્ચે ધરપકડ બાદ જામીન મુક્ત કર્યા હતા. સુરતના જહાંગીરપુરાની પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનું ડાંગર ખરીદ્યા બાદ બાકી નિકળતી રકમ રૂ.૨૭,૭૬,૫૧,૩૫૦.૨૮ ચૂકવવા માટે વાયદા પર વાયદાઓ કરતા આખરે મંડળીના મેનેજર સુરેશભાઈ ભવનભાઈ પટેલ (રહે. સુરત) એ નવસારી સુપાની

પૌઆ મિલ શ્રી સાંઈ હસ્તી પ્રોડક્ટ લી ના માલિક દંપતિ પ્રજેશભાઈ રમેશચંદ્ર નાયક અને મોનાબેન પ્રજેશભાઈ નાયક (બંને રહે.સુપા, નવસારી) અને મંડળીના ભૂતપૂર્વ ચેરમેન જયેશભાઈ શંકરભાઈ પટેલ (પાલ) (ઉ.વ.૬૧, સુરત) વિરુદ્ધ ૪૨૦,૪૦૬ સહિત અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટે પોલીસ કમિશ્નર સમક્ષ બે મહિના અગાઉ અરજી કરતા સહકાર ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન, આ અરજીના આધારે સુરત કાર્ડમ બ્રાન્ચે ગત ૮ માર્ચના રોજ મેનેજરની ફરિયાદ લઈ ત્રણેય વિરુદ્ધ રૂ.૨૭.૭૭ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, ત્રણેયે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે જયેશ પટેલ અને મોનાબેનના આગોતરા જામીન મંજૂર કરતા બંને ગતરોજ કાર્ડમ બ્રાન્ચમાં હાજર થયા હતા. કાર્ડમ બ્રાન્ચે બંનેની ધરપકડ બાદ જામીન મુક્ત કર્યા હતા.

## સુરતમાં વિધિના નામે માતા-પુત્રી પર રેપ કરનાર 'બાબા'ને આજીવન કેદ

પતિ-પિતાને સાજો કરવા હોય તો હું કહું તેમ કરવું પડશે કહીને કુકર્મ કરતો હતો

સુરત

તારા પતિ-પિતાને સાજો કરવા હોય તો હું કહું તેમ કરવું પડશે એમ કહીને બત્રીસ વર્ષના અકમલ બાબાએ એકથી વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો. પાંચેક વર્ષ પહેલા શ્રમજીવી મહીલાના બિમાર પતિને દોરાધાગાથી સાજો કરવાના બહાને તાંત્રિક વિધીના આડમાં તેની પત્ની તથા ૧૪ વર્ષની સગીર પુત્રી સાથે એકથી વધુવાર બળાત્કાર ગુજારીને ધાકધમકી આપનાર આરોપી બાબાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના જજ આરતી અદૈત વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટ તથા એટ્રોસીટી એક્ટના ભંગ બદલ આજીવન કેદ, ૧૦ હજાર

દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૪ લાખ વળતર ચુકવા નિર્દેશ આપ્યો છે.

નાનપુરા હબીબશા મહોલ્લામાં રહેતા તથા દોરા ધાગા તથા મંત્રતંત્ર વિધી કરતાં ૩૨ વર્ષીય આરોપી અકમલ ઉર્ફે અકમલ બાબા અખતર રજા શેખ વિરુદ્ધ તા.૨-૩-૨૦૧૭ના રોજ શ્રમજીવી પરિવારની મહીલાએ પોતાના બિમાર પતિને સાજો કરવાના નામે તાંત્રિક વિધીના બહાને પોતાના તથા ૧૪ વર્ષીય સગીર પુત્રીને ધાકધમકી આપીને એકથી વધુવાર બળાત્કાર ગુજારવા અંગે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

## દસ્તાવેજો બદલી કૌભાંડમાં અડાજણના બિલ્ડર પુત્ર સંજય શાહની ધરપકડ કરાઈ

કચેરીમાંથી જે ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ મુકાવ્યા હતા

સુરત

સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગના એ બ્લોકમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. ૧૧૪૩, ૧૧૪૪, ૧૮૮૯, ૧૮૯૦ અને ૧૮૯૭થી નોંધાયેલા ડુમસ, ખજોદ, વેસુ અને સિંગણપોરની જમીનના ઓરીજનલ દસ્તાવેજ બદલવાના કૌભાંડમાં ખેડૂત વિજય છીબુ પટેલ (રહે. સરોધી ગામ, તા. પારડી, જિ. વલસાડ)ના ઘરેથી ચાર સાટાખત અને કબ્જા રસીદ ઉપરાંત ૧૦ લાખ રોકડા કબ્જે કરનાર કાર્ડમ બ્રાંચની એસઆઈટીએ આ પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે અડાજણ પાટીયા પાસેથી છટકી જનાર

સંજય જવાહર શાહ ઉર્ફે એસ.કે (રહે. સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટ, મધુવન સર્કલ, એલ.પી. સવાણી રોડ, અડાજણ)ને નાનપુરા કનકનિધી એપાર્ટમેન્ટ પાસેથી કાર્ડમ બ્રાંચે દબોચ્યો હતો.

જેની આજ રોજ સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સબ રજીસ્ટ્રાર કચેરીના ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી તેમાં બોગસ દસ્તાવેજ મુકી કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે પચાવી પાડવાનો ખેલ રચનાર ટોળકી પૈકીનો સંજય શાહ ઉર્ફે એસ.કે રજીસ્ટ્રાર કચેરીમાંથી ગાયબ થયેલા ઓરીજનલ દસ્તાવેજના બદલે જે બોગસ દસ્તાવેજ મુકવામાં આવ્યા હતા તેમાં મહત્વની ભુમિકા હોવાનું જાણવા મળ્યું છે.

**First Flight**  
FFCL Couriers Inc.

દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

**તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ**

<p><b>1 LB \$20 વધુ દર LB ના \$6</b>  <b>11 LB \$55 વધુ દર LB ના \$6</b>  <b>23 KG \$185, વધુ દર KG ના \$10</b>  <b>30 KG \$230, વધુ દર KG ના \$10</b></p>	<p><b>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</b></p>
--	--

**જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ**

<p><b>Brampton (West)</b> 519, Ray lawson boulevard, Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p><b>Scarborough</b> WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road &amp; Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p><b>Mississauga</b> WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM</p>
--	---	--

**૬૪૭-૭૬૧-૧૩૧૭**      [www.firstflightcanada.com](http://www.firstflightcanada.com)

**સ્વદેશ**  
CANADA  
Registration # 869127209  
Publication Mail Agreement /  
Email : info@swadesh.news

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**  
MAILING ADDRESS  
23 Lyric Road,  
Brampton ON L6S 0B4.  
416-996-7755  
Registered Address  
713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi  
Director : Nilesh Tailor  
Sub Editor : Chhaya Gandhi  
Montreal Bureau : Vijay Patel (514-826-7442)

Designed By  
Sabir Daroga  
Mevada Piyush  
Firoz Shaikh

**GUJARAT OFFICE MAC AGENCIES :** F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.





## 84 વર્ષની વયે હેલન ઓટીટી વેબ સિરીઝથી કમબેક કરશે

મુંબઈ : બોલિવુડમાં આઈટમ સોંગની બોલબાલા આજની નથી. દાયકાઓ અગાઉ હેલને તે વખતે કલબ સોંગ તરીકે ઓળખાતાં આઈટમ સોંગથી પોતાની અલગ ઓળખ બનાવી હતી. સલમાન ખાનની સાવકી માતા હેલન હવે ૮૪ વર્ષની વયે ઓટીટી વેબ સિરીઝમાં દેખા દેશે. પ્રાક માહિતી મુજબ એક કાર્યમ શ્રીલક વેબ સિરીઝ બ્રાઉનમાં હેલન અને કરિશ્મા કપૂર સાથે સ્ક્રિન શેર કરવાનાં છે. હેલનને આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે ટીમ તેમની ભૂમિકા અંગે એકદમ સ્વચ્છ હોવાનું તેમને જણાવ્યું હતું.



### ટ્રોલ થયા બાદ મહેશબાબુએ બોલિવુડ વિશે ફેરવી તોણ્યું



મુંબઈ : બોલિવુડ મને અફોર્ડ નહીં કરી શકે અને મારે હિંદી ફિલ્મોમાં સમય નથી વેડફવો એવું કહ્યા બાદ તેલુગુ સુપર સ્ટાર મહેશબાબુની ભારે ટીકાઓ થઈ હતી. આખરે, મહેશ બાબુએ એક ખુલાસો પ્રગટ કરી પોતાને ખોટી રીતે ટાંકવામાં આવ્યો હોવાનો બચાવ કર્યો છે. મહેશબાબુએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કોઈપણ ભાષાને નીચું દેખાડવાનો પોતાનો કોઈ ઈરાદો ન હતો. પોતે માત્ર એમ કહેવા માગતો હતો કે તેલુગુ ફિલ્મોમાં જ કામ કરીને પોતે ખુશ છે અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગને આગળ લઈ જવા માગે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશબાબુ આગામી તેલુગુ ફિલ્મ મેજરનો પ્રોડ્યુસર છે. અને મેજર ફિલ્મના પ્રમોશનમાં આ ઉચ્ચારણો નડતર રુપ ના બને તે માટે હવે ખુલાસો થઈ રહ્યો છે. જોકે, મહેશ બાબુની મુશ્કેલીનો તત્કાળ અંત આવે તેમ લાગતું નથી. તેનો પાંચ વર્ષ જૂનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તે એમ કહેતાં સંભળાય છે કે મારે બોલિવુડની હોડમાં સામેલ થવું નથી. હું તેલુગુ ફિલ્મોનો પ્રિન્સ છે. મારે બોલિવુડમાં ભિખારી નથી બનવું. મહેશ બાબુ એક ફિલ્મ માટે ૮૦ કરોડ રુપિયાની ફી લે છે. આ સંજોગોમાં પોતે બોલિવુડને પરવડી નહીં શકે તેવી કોમેન્ટની બહુ લોકોએ મજાક ઉડાવી છે.

## હું સુગર નથી લેતી એવું કહીને આલિયા ભટ્ટ ફસાઈ ગઈ

લોકોએ આલિયાની ઠંડાપીણાં, ચોકલેટ, ફૂટ સિરપ સહિતની અનેક સુગર પ્રોડક્ટ્સની એડ પોસ્ટ કરી

મુંબઈ : બોલિવુડ સ્ટાર્સ પોતે જે વસ્તુની જાહેરખબર કરે છે તેનો ક્યારેય યૂઝ કરતા હોતા નથી અને માત્ર પૈસા લઈને પ્રચાર કરવા ખાતર જ જે તે બ્રાન્ડ એન્ડોર્સ કરતા હોય છે એ તો સૌ જાણે છે પરંતુ આરોગ્ય વિષયક સલાહો આપે અને પછી પોતે બિનઆરોગ્યપ્રદ ચીજોને પ્રચાર કરે ત્યારે ભારે ટ્રોલ થાય છે. તાજેતરમાં આલિયા ભટ્ટ પણ પોતે સુગર નહીં લેતી હોવાનો દાવો કરીને ભેરવાઈ ગઈ છે. એક ટીવી કોમેડી શો માં આલિયા ભટ્ટને ચા નો કપ ધરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેમાં સુગર છે. ત્યારે આલિયા આ કપ સ્વીકારવાનો

એમ કહીને ઈનકાર કરી દે છે કે પોતે બિલકૂલ સુગર લેતી નથી. આ સીન સંદર્ભમાં લોકોએ આલિયાના દંભને ભારે વખોડ્યો છે. કેટલાય લોકોએ સોશિયલ મીડિયા પર એવી એકથી વધુ એડની ક્લિપ મુકી દીધી હતી જેમાં આલિયાએ ઠંડાપીણાં, ચોકલેટ, ફૂટ સિરપ સહિતની સુગરનું બિનઆરોગ્યપ્રદ પ્રમાણ ધરાવતી ચીજોનું એન્ડોર્સમેન્ટ કર્યું છે. લોકે આલિયાને ટ્રોલ કરતાં કહી રહ્યા છે કે બોલિવુડ સ્ટાર્સ જે ચીજોની જાહેરખબર કરે છે તેના પર રાય ભરોસો કરશો નહીં.



### મિસ ન્યૂ જર્સી એમિલી શાહનું બોલિવુડમાં જંગલ કાય ફિલ્મથી ડેબ્યૂ



મુંબઈ : મિસ ન્યૂ જર્સીનો ખિતાબ મેળવનારી અભિનેત્રી એમિલી શાહની ફિલ્મ જંગલ કાય ભારતમાં ઓટીટી પર અને વિદેશમાં થિયેટર્સમાં રજૂ થવાની છે. ઓરિસ્સાના આદિવાસી બાળકોની ફૂટબોલ ટીમ પર આધારિત આ ફિલ્મ અગાઉ ૪ જુદા જુદા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ તથા પ્રશંસા પામી ચુકી છે. એમિલી આ ફિલ્મમાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકામાં છે. ઓરિસ્સાના આદિવાસી બાળકોને ટ્રેનિંગ અને પ્રોત્સાહન આપી તેમની ફૂટબોલ ટીમ રચવામાં આવે છે. પગમાં પગરખાં પણ નહીં પહેરનારા બાળકો રગ્ગી કપમાં ભાગ લેવા માટે આગળ વધે છે તેવી ફિલ્મની વાર્તા છે. એમિલીના પિતા પ્રશાંત શાહ ફિલ્મ પ્રોડ્યુસર છે.

## સોનાક્ષી સિન્હાએ સગાઈ કરી લીધી હોવાની અફવા



સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી ત્યારબાદ એક્ટ્રેસની સગાઈના સમાચાર ચારે તરફ ઉડવા લાગ્યા હતા. સોનાક્ષીએ જે રીતે આ તસવીરો શેર કરી છે અને કેપ્શન આપ્યું છે તેના કારણે આ સમાચાર ફેલાયા હતા. સોનાક્ષીએ પોતાની તાજેતરની એક તસવીર અને વીડિયો પણ શેર કર્યો છે. જે સ્પષ્ટ કરે છે કે સોનાક્ષી શું કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, તેના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતી સોનાક્ષી એક મિસ્ડ્રીમેનનો હાથ પકડેલી જોવા મળી હતી. આ સાથે જ સોનાક્ષીએ તેની તસવીરોને કેપ્શન આપ્યું હતું કે, 'હું જે દિવસની રાહ જોઈ રહી હતી તે આવી ગયો છે. હવે ચાહકોમાં આ તસવીર જોઈને તેમની સગાઈની અફવા ઉડી ગઈ છે.

હકીકતમાં સોનાક્ષી પોતાની નવી આર્ટિફિશિયલ નેઈલ બ્રાન્ડ લાવી રહી છે. જૂની તસવીરોમાં પણ અભિનેત્રી પોતાના સુંદર નખ બતાવતી જોવા મળી હતી. સોનાક્ષીની આ બ્રાન્ડનું નામ SOEZI છે. સોનાક્ષી આ બ્યુટી કેર બ્રાન્ડ સાથે બીજું શું લાવવા જઈ રહી છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આ પગલાથી સોનાક્ષી બોલીવુડની એવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ગઈ છે જેઓ ફિલ્મો સિવાય બિઝનેસ ચલાવે છે. આવી અભિનેત્રીઓમાં અનુષ્કા શર્મા, કેટરિના કૈફથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક અભિનેત્રીઓના નામ સામેલ છે. અનુષ્કા 'નુશ' નામની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે જ્યારે સોનલ કપૂર અને રિયા કપૂરની 'રીઝન' નામની કપડાંની બ્રાન્ડ છે. કેટરિના કૈફ 'કે બ્યુટી' નામની કોસ્મેટિક બ્રાન્ડની માલિક છે જ્યારે આલિયા ભટ્ટ પ્રોડક્શન હાઉસ સિવાય કપડાંની બ્રાન્ડ પણ ચલાવે છે.

## પુજા હેગડે, તમન્ના, હીના ખાન, નયનતારા 'કાન'માં રેડ કાર્પેટ પર

મુંબઈ : આગામી તા. ૧૭મી થી કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમાં ભારત તરફથી પૂજા હેગડેની રેડ કાર્પેટ પર પહેલીવાર એન્ટ્રી થશે. આ ઉપરાંત સાઉથની નયનતારા અને દીવીની હીના ખાન અને તમન્ના ભાટિયા પણ રેડ કાર્પેટ પર જોવા મળશે. કાન ફેસ્ટિવલમાં ભાગ લેનારા ભારતીય સિતારાઓની યાદીમાં નવાં નામો ઉમેરાઈ રહ્યાં છે. નવી વિગતો અનુસાર પુજા હેગડે પહેલીવાર કાનમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની છે. પૂજા સાથે જ સાઉથની સ્ટાર નયનતારા પણ રેડ કાર્પેટ પર કામણા પાથરશે. ઓટીટી અને દીવીની સ્ટાર હીના ખાન તથા તમન્ના ભાટિયા પણ રેડ કાર્પેટ પર ડગલાં માંડવાના છે. આ વખતે આ ફેસ્ટિવલનું ૭૫મું



માધવનની ફિલ્મનું પ્રિમિયર: અક્ષય, નવાઝુદ્દિન, રહેમાન સહિતના ભારતીય સેલેબ્સ ભાગ લશે

વર્ષ છે તે નિમિત્તે ભારતીય ફિલ્મો પર વિશેષ શો, ડિબેટ અને અન્ય ઈવેન્ટ્સ યોજાઈ છે. આર. માધવનની ફિલ્મ રોકેટ્ટીનું પ્રિમિયર પણ ફેસ્ટિવલ દરમિયાન યોજાવાનું છે. સાઉથમાં એ. આર. રહેમાન પણ કાનમાં ભાગ લેવાના છે. તેમની સાથે દિગ્દર્શક શેખર કપૂર અને ગીતકાર તથા સેન્સર બોર્ડના ચેરમેને પ્રસૂન જોશી પણ ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેશે. મૈઈન સ્ટ્રીમ બોલિવુડના સિતારાઓમાંથી અક્ષય કુમાર તથા એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકી ઉપરાંત રાજસ્થાનના લોક ગાયક મેમે ખાનને પણ કાન ફેસ્ટિવલમાં આમંત્રણ મળ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારતીય અભિનેત્રી દિપીકા પાદુકોણની આ વખતે કાનમાં જ્યૂરી મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી છે.



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

 માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી  
 અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

 રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ,  
 પ્રવાસ-પર્વટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



અમેરિકાના ડોલરનો મુકાબલો કરવા માટે ચીન હવે ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરશે

# અમેરિકા સામે ચીન હવે આર્થિક યુદ્ધની પેતરણમાં

ચીન અને અમેરિકા બે-અઢી દાયકાથી એકબીજા સામે ટકરાયા કરે છે. વૈશ્વિક ધરી પર પણ એક યા બીજા મુદ્દે તે આમને સામને રહે છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ ભવિષ્યમાં જે ક્રન્સી યુદ્ધ અમેરિકા અને ચીન વચ્ચે થવાનું છે તે કદાચ યુક્રેનના યુદ્ધ કરતાં પણ ભીષણ હશે. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૪માં ન્યુ હેમ્પશાયરના બ્રેટન વૂડમાં ૪૪ મિત્રદેશોના પ્રતિનિધિઓ મળ્યા હતા. તેમણે વિદેશ વેપાર માટે રિઝર્વ ક્રન્સી તરીકે અમેરિકાના ડોલરને સ્વીકાર્યો હતો. ત્યારે અમેરિકાના ડોલરની સરખામણી સુવર્ણ સાથે કરાઈ હતી. અર્થાત્ ફેડરલ રિઝર્વ ડોલરના બદલામાં સોનું આપવાને બંધાયેલી હતી. ૧૯૬૧માં ફેડરલ રિઝર્વે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ત્યજી દીધું તો પણ દુનિયાની રિઝર્વ ક્રન્સી તરીકે ડોલરનું ચલણ કાયમ રહ્યું હતું. આજની તારીખમાં દુનિયાની બેન્કોનું ૬૧ ટકા અનામત ભંડોળ ડોલરના સ્વરૂપમાં છે. કોઈ દેશો ડોલરની નોટો રાખે છે તો કોઈ તેનું રોકાણ અમેરિકી સરકારના બોન્ડમાં કરે છે.

દુનિયાનું જે ૪૦ ટકા ઋણ છે તે પણ ડોલરના રૂપમાં છે. હવે બીજી તરફ અમેરિકા સાથે સતત સંઘર્ષમાં રહેતા ચીનનું અર્થતંત્ર ઘણાં સમયથી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ચીન જગતના અર્થતંત્રમાં ડોલરના પ્રભાવને ખતમ કરવા સાથે યુઆનનો પ્રભાવ સ્થાપિત કરવાની મથામણ કરી રહ્યું છે. વર્તમાનમાં ખનીજ તેલનું ઉત્પાદન કરતાં દેશો તેમનું ઓઈલનું વેચાણ કરે તો તેના બદલામાં ડોલર જ લે છે. તેથી દુનિયાના લગભગ તમામ દેશોને ડોલરની જરૂર પડે છે. અમેરિકાનું બાહ્ય દેવું વધીને આશરે ૬,૦૦૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે, જેમાંનું ૧,૦૦૦ અબજનું દેવું ચીન સાથેના વેપારમાં થઈ ગયું છે. ચીન જો તેની પાસેના ડોલર વેચવા કાઢે તો અમેરિકાનું અર્થતંત્ર ખતમ થઈ જાય, પણ તે પહેલાં વિશ્વયુદ્ધ થઈ જાય તેમ છે. આ કારણે ચીને અમેરિકાને હરાવવા માટે આર્થિક યુદ્ધ છોડી દીધું છે. ચીન તેના યુઆનને ડોલરના સ્થાને રિઝર્વ ક્રન્સી તરીકે સ્થાપિત કરવા પ્રયાસો કરવા માંડ્યું છે. જો કે, આરબ દેશો અમેરિકાની પડખે હોવાથી ચીનને હજી સફળતા મળતી નથી. હવે ડોલરનો મુકાબલો કરવા માટે ચીને ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

ડોલરની મોનોપોલી ખતમ કરવા રશિયા અને ચીન મળીને આરબ દેશોને તેમનું ખનીજ



તેલ ડોલરને બદલે રૂબલમાં અને યુઆનમાં વેચવા સમજાવટ કરી રહ્યા છે.

આમ પણ દુનિયાનું અર્થતંત્ર ધીમા પગલે પહેલાં ડિજિટલ ક્રન્સી તરફ અને પછી ક્રિપ્ટોકરન્સી તરફ આગળ વધી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. બ્લોકચેઇન ટેકનોલોજીના આધારે પેદા થતી ક્રિપ્ટોકરન્સી છેલ્લા એક દાયકાથી ચલણમાં છે, પણ તેની લે-વેચ ખાનગી સાહસિકો કરે છે. તેનો ઉપયોગ રોકાણના માધ્યમ તરીકે અને સહા માટે વધુ થાય છે. વિનિમયના માધ્યમ તરીકે હજુ સુધી કોઈ દેશમાં ક્રિપ્ટોકરન્સીને મંજૂરી મળી નથી. ભારતની રિઝર્વ બેન્કે બે વર્ષ પહેલાં ક્રિપ્ટોકરન્સીની લે-વેચ પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટે તે

**પ્રાસંગિક**  
**ધવલ શુક્લ**

ક્રિપ્ટોકરન્સીની દિશામાં આ ચીનનું પહેલું પગલું હશે. ચીનની ક્રિપ્ટોકરન્સી ડિજિટલ ક્રન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ (ડીસી/ઈપી) તરીકે ઓળખાશે.

ચીને તેની સંભવિત ક્રિપ્ટોકરન્સીના જે ફોટા જાહેર કર્યા છે તે જોતા તેનું નામ યુઆન જ હશે તેમ લાગે છે. પણ તેની લેવડદેવડ માત્ર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જ કરી શકાશે. વિશ્વના કોઈ પણ દેશે ચીન પાસેથી માલ ખરીદવો હશે તો તે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં જ ખરીદવો પડશે. ચીન સાથે સ્પર્ધા કરવા દુનિયાના બીજા દેશો પણ પોતપોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરશે. છેવટે એક સમય એવો આવશે કે દુનિયામાં પેપર ક્રન્સીનું ચલણ ખતમ થઈ જશે અને બધા વહેવારો ક્રિપ્ટોકરન્સીમાં જ કરવા પડશે.

**ઓઈલ વેચાણના કિસ્સામાં ચીન તેના યુઆનને ડોલરના સ્થાને રિઝર્વ ક્રન્સી તરીકે સ્થાપિત કરવા માંગે છે, પરંતુ આરબ દેશો અમેરિકાની પડખે હોવાથી સફળતા મળતી નથી**

પ્રતિબંધ ઉઠાવી લીધો છે. તેને કારણે ભારતમાં પણ સરકાર પ્રેરિત ક્રિપ્ટોકરન્સીના પ્રારંભ થઈ શકે છે. કોરોનાની કટોકટી વચ્ચે ચીને તારપ એપ્રિલે જાહેરાત કરી હતી કે, તે બ્લોકચેઇન સર્વિસ નેટવર્ક (બીએસએન) ના નામે તેનું પહેલવહેલું નેશનલ બ્લોકચેઇન પ્લેટફોર્મ તરતું મૂકશે. જાણકારોના મતે સરકાર દ્વારા સમર્થિત

ચીનની સામ્યવાદી સરકાર છેક ૨૦૧૪થી ક્રિપ્ટોકરન્સીનો વિકાસ કરવાનો મનસુબો ધરાવે છે. થોડા સમય પહેલાં ફેસબુકે પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનું નામ લિબ્રા પાડવામાં આવ્યું હતું. ફેસબુકના વિશ્વભરમાં ૨.૩ અબજ વપરાશકારો હોવાથી તેની ક્રિપ્ટોકરન્સી લોન્ચિંગ સાથે જ હિટ પુરવાર

થાય તેવી સંભાવના હતી. ફેસબુકની જાહેરાત પછી અમેરિકાની સરકાર પણ તેની પોતાની ક્રિપ્ટોકરન્સી બહાર પાડવાની વિચારણા ચલાવી રહી હતી, પણ ચીન તે બાબતમાં આગળ વધી ગયું છે. ચીનનું ઉદાહરણ લઈને દક્ષિણ કોરિયા, રશિયા, સ્વીડન વગેરે ઘણા દેશોની સરકારો દ્વારા તેમની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ ક્રન્સી બહાર પાડવાની તૈયારી કરી છે. ભારતની સરકાર પણ આ દિશામાં પ્રયાસો કરી રહ્યાનું કહેવાય છે.

ભારત સરકાર દ્વારા ડિજિટલ ક્રન્સીનો પ્રચાર થઈ રહ્યો છે તે પણ ક્રિપ્ટોકરન્સીની દિશામાં આગેકૂચ છે. ક્રિપ્ટોકરન્સી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપી શકાતી નથી, પણ તેનું ઈન્ટરનેટ ઉપર માઈનિંગ કરવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીનું માઈનિંગ કરવા માટે કેટલાક ગાણિતિક કોયડા ઉકેલવાના હોય છે. આ કોયડા એક વ્યક્તિ ઉકેલી શકે તેવા હોતા નથી, માટે ઘણા બધા લોકો સાથે મળીને તે કોયડા ઉકેલતા હોય છે. તેઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં રહેતા હોય છે અને પોતાના કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય છે. આ બધાં કોમ્પ્યુટરો બ્લોકચેઇન ટેકનોલોજી વડે જોડાયેલાં હોય છે. જેથી એક કોયડા પર એક સમયે ઘણા બધા નિષ્ણાતો કામ કરી શકે છે. આ ટેકનોલોજીમાં કોઈ એક સર્વર નથી હોતું, પણ સિસ્ટમ સાથે જોડાયેલાં બધાં કોમ્પ્યુટરો સર્વરનું કામ કરે છે. આ ચેઇનમાં જોડાયેલા બધા લોકો બધા ટ્રાન્સેક્શન જોઈ શકે છે. પારદર્શકતાને કારણે ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડીનો અવકાશ રહેતો નથી.

દુનિયામાં આજે બે ડઝનથી વધુ ખાનગી ક્રિપ્ટોકરન્સી પ્રચલિત છે, જેમાં મુખ્ય બિટકોઈન છે. બિટકોઈન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત એક ડોલર જેટલી હતી. કોઈ સમયે તેની કિંમત વધીને ૧૦,૦૦૦ ડોલર પર પહોંચી ગઈ હતી. ક્રિપ્ટોકરન્સીની ખાસિયત છે કે તેની નકલ કરી શકાતી નથી અને તેની ચોરી કરી શકાતી નથી. જે રીતે ડિજિટલ ક્રન્સીની લેવડદેવડ મોબાઈલ વડે કરી શકાય છે તેમ ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ પણ મોબાઈલ વડે થઈ શકે છે. જો તેના માટે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવો હોય તો બ્લુટુથ વડે પણ લેવડદેવડ કરી શકાય છે. ચીની સરકાર દ્વારા જ્યારે પણ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવામાં આવશે ત્યારે તેનો સંપૂર્ણ કન્ટ્રોલ સરકારના હાથમાં જ હશે તેમાં કોઈ શંકા નથી. વર્તમાનમાં ચીન સરકાર દ્વારા તેના વિષયક કાયદાઓ ઘડાઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ તેનો દુરુપયોગ કરી શકે નહીં.









# અદાણી અને અંબાણી સહિત ટોપ ટેન બિલિયોનર્સની સંપત્તિમાં થયો ઘટાડો

પહેલી જ વખત વિશ્વના નંબર વન બનેલા એલન મસ્કની સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો

નવી દિલ્હી

વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર બિલિયોનર્સની યાદી દર વર્ષે પ્રગટ કરનાર ફોર્બ્સની 36મી યાદીમાં પહેલી જ વખત ટોપ ટેન બિલિયોનર્સની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં વધારાને બદલે ઘટાડો થયો છે. છતાં તેમની સંપત્તિ સૌથી વધુ છે.



ફોર્બ્સની આ યાદીમાં 7 બિલિયોનર્સ અમેરિકાના છે, બે ભારતના છે જેમાં અદાણી અને અંબાણી સહિત ટોપ ટેન બિલિયોનર્સની સંપત્તિમાં મોટો ઘટાડો થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત

અને એક ફ્રાન્સનો છે. ટોપ ટેનમાં અમેરિકા પછી બીજા નંબરે ભારત છે. કોરોના પેન્ડેમિક અને યૂકેન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં બિલિયોનર્સની સંખ્યામાં ઘટાડો થયો છે. યાદીમાં કુલ 2,668 બિલિયોનર્સ છે જે ગયા

વર્ષ કરતાં 87 ઓછા છે. તેમની કુલ સંપત્તિ 12.7 લાખ કરોડ ડોલર છે એમાં પણ ગયા વર્ષ કરતાં 40,000 કરોડ ડોલરનો ઘટાડો છે. 2,668માંથી માત્ર 1,000 એવા છે જેમની સંપત્તિમાં આફતો છતાં ગયા વર્ષ કરતાં વધારો થયો છે. બાકી બધાની સંપત્તિમાં ઘટાડો થયો છે. યૂકેન પર આક્રમણના કારણે આવેલા આર્થિક પ્રતિભાવના કારણે રશિયાના 34 બિલિયોનર ઘટયા છે અને ચીનની સરકારે કડક હાથે કામ લેતાં ચીનના 87 બિલિયોનર ઓછા થયા છે.

# મોદીના જીવકાળ અંગે બનેલી બુક રાજનીતિની 'ગીતા' બનશે: શાંદ

નવી દિલ્હી

વર્ષ 2002ના ગુજરાતના રમખાણોમાં શંકાની સોયથી લઈને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની સફર ખેડનાર નરેન્દ્ર મોદીના જીવન પર બનેલ એક પુસ્તકનું લોન્ચિંગ બીજેપીના ચાણક્ય ગણાતા અમિત શાંદે કર્યું છે. અમિત શાંદે પીએમ નરેન્દ્ર મોદીના 20 વર્ષના રાજકીય જીવન પરના પુસ્તકને રાજકારણમાં સક્રિય લોકો માટે 'કૃષ્ણની ગીતા' સમાન ગણાવ્યું છે.



અમિત શાંદે પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું કે હું આ પુસ્તકમાં આપવામાં આવેલા ચેપ્ટર વિશે નહીં પરંતુ પીએમ નરેન્દ્ર મોદી વિશે વાત

કરીશ. તેમણે કહ્યું કે આ પુસ્તક મોદીજીના 20 વર્ષના અનુભવની વાત કરે છે, પરંતુ તે પહેલાની 30 વર્ષની તેમની સફરને જાણવા વિના તેમને જાણવા અધૂરા છે. એક માણસ જે ક્યારેય પંચાયતનો સભ્ય પણ નહોતો અને આજે તે વૈશ્વિક નેતા બન્યો છે, તેણે આ સિદ્ધિ કઈ રીતે હાંસલ કરી તે જાણવાની જરૂર છે.

# અસાની વાવાઝોડું નબળું, ઓડિશા અને બંગાળમાં હજુ ભારે વરસાદ આગાહી

ડીપ્રેશનના લીધે આંધ્રમાં હળવાથી વરસાદની ભીતિ



ભુવનેશ્વર

અસાની વાવાઝોડું નબળું પડતું પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક હિસ્સા ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના પૂર્વી કિનારે પ્રતિ કલાક ૮૫ કિ.મી.ની ઝડપે અથડાયુ હતુ, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ વાવાઝોડું વધારે નબળુ પડતા ગુરુવારે સુધીમાં તે ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ બાજુએ વાવાઝોડું છે તા રાજસ્થાન ૪૬થી ૪૭ ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. તેમા પણ જાલોરમાં ૪૭ ડિગ્રીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.

તેવી સંભાવના છે. તે ઉત્તર તરફ આગળ વધીને બપોરથી સાંજ સુધીમાં નરસાપુર, યનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના કાંઠે અથડાઈ શકે છે. તે રાત સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ વટાવીને પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે. ઓડિશા સરકારનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં રાજ્યમાં કેટલાક દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ તેનાથી વિશેષ કોઈ અસર નહી થાય. ઓડિશા સરકારે પાંચ દક્ષિણી જિલ્લા મલ્કાન્ગીરી, કોરાપુટ, રાયગડા, ગંજમ અને ગજપતિનેહાઈ એલર્ટ પર મુક્યા છે. આ પાંચેય જિલ્લામાં વાવાઝોડાની અસર પડી શકે છે. આ સિવાય ઓડિશામાં બીજી કોઈ ખાસ અસર થાય તેવી સંભાવના નથી.

# કેરળમાં ટોમેટો ફિવરનો કહેર: કોલ્લમ જિલ્લામાં ૮૦થી વધુ બાળકો ચપેટમાં

કર્ણાટકમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ, તમિલનાડુ બોર્ડર પાસે મુસાફરોના ટેસ્ટ કરવાનો આદેશ

બેંગ્લોર

કેરળ રાજ્યમાં અત્યારે દુર્લભ વાયરલ બીમારી ટોમેટો ફીવર અથવા ટોમેટો ફ્લુના કેસ વધી રહ્યા છે જેના કારણે પાડોશી રાજ્ય કર્ણાટકમાં પણ હાઈ એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી હતી. બુધવારના રોજ કેરળ બોર્ડર પાસેના જિલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બોર્ડર પાસેના જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર્સ(ડીએચઓ) ને આદેશ આપવામાં આવ્યો હતો કે ખાનગી અને સરકારી મેડિકલ

સંસ્થાઓમાં ઓપીડી વિભાગમાં આવતા દર્દીઓ પર સતત નજર રાખવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લામાં અને તેની આસપાસના વિસ્તારોમાં ૮૦ કરતા વધારે બાળકો ટોમેટો ફીવરનો શિકાર બન્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કર્મચારીઓ જણાવે છે કે, ગણતરીના દિવસોમાં કેરળના વિવિધ વિસ્તારોમાં ૮૦ કરતા વધારે બાળકોમાં આ બીમારી સામે આવી હતી. એકાએક

જ આ બીમારીના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૮૦થી વધારે બાળકો આ બીમારીનો શિકાર બન્યા છે અને આ આંકડો વધવાની શક્યતા છે. તમિલનાડુ બોર્ડર પાસે પણ મુસાફરોના ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ચકાસવા માટે કેરળ સરકાર દ્વારા ૨૪ સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે.

# બિલ્ડરના ઘરે દરોડામાં મળ્યા ૩૦ કરોડ, કેસ દબાવવા ૬ કરોડ લીધા

૩ પોલીસકર્મીઓ ઉપરાંત ૭ અન્ય કર્મચારીઓ સસ્પેન્ડ

મુંબઈ

મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશનના ૩ અધિકારીઓ અને ૭ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે એક બિલ્ડર પાસે બ્લેક મની હોવાની ખાતમીના આધાર પર તેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન તેમને ૩૦ કરોડ રૂપિયાની રોકડ મળી હતી. આરોપ પ્રમાણે ત્રણેય પોલીસ અધિકારીઓએ કેસ દબાવવા માટે બિલ્ડર પાસેથી બળજબરીથી ૬ કરોડ રૂપિયા લઈ લીધા હતા. થાણે શહેર પોલીસના ટોચના અધિકારીઓને આ


અંગેની ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ બાદ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ થાણે શહેર પોલીસે મુંબ્રા પરિમંડલના સહાયક કમિશનર વ્યંકટ આંધળે અને મુંબ્રા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અશોક કડલકની ડિપાર્ટમેન્ટલ તપાસનો આદેશ આપ્યો હતો. હાલ આરોપી પોલીસ કર્મચારી મેડીકલ લીવ પર જતા રહ્યા છે. તપાસ બાદ મુંબ્રા પોલીસ સ્ટેશનના ગીતારામ શેવાલે, હર્ષદ કાલે અને મદને સામે કાર્યવાહી કરવામાં આવી છે.

# બાળકી પર રેપ કરી ગર્ભવતી બનાવનારા પિતાને ૧૦૬ વર્ષની કેદ

તિરુઅનંતપુરમ

કેરળમાં એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એક કેસમાં પોકસોની જુદી જુદી કલમો હેઠળ એક અપરાધીને ૧૦૬ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા પાંચ અપરાધોમાં આ વ્યક્તિને કોર્ટે ૧૭ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ કેસમાં અપરાધી અન્ય કોઈ નહીં પણ પીડિત સગિરાનો પિતા જ છે. આરોપ છે કે પિતા પોતાની જ ૧૨ વર્ષથી નાની બાળકી પર ૨૦૧૫થી વારંવાર બળાત્કાર કરતો હતો,

# હિમાચલ પ્રદેશની રાજનીતિના ચાણક્ય પંડિત સુખરામનું અવસાન



પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંડિત સુખરામ શર્માનું ૯૪ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ગત ૭મી મેથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ગત ૪ મેના રોજ તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેમને મંડી (હિમાચલ પ્રદેશ)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એરલિફ્ટ કરીને દિલ્હી એઈસસ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

# જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટનો મહત્વનો નિર્ણય

# જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે ચાલુ રહેશે કોર્ટ કમિશનરને હટાવવાનો ઈન્કાર

વારાણસી

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરેલા એડવોકેટ કમિશનર અજય મિશ્રાને હટાવવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે ૧૭મી મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાનો સર્વે કરવા આદેશ આપ્યો છે. કોર્ટે ૧૭મી મેના રોજ સર્વેનો આગામી રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે. અદાલતે કોર્ટ કમિશનર અજય

મિશ્રા ઉપરાંત વિશાલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવ્યા છે. તે બંને અથવા તો તે બંને પૈકી કોઈ એક આ સર્વે દરમિયાન ઉપસ્થિત રહેશે. ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું કે, કોર્ટે સમગ્ર મસ્જિદ પરિસરનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર અને પ્રશાસનને આદેશ આપવામાં આવ્યો છે કે, આ કાર્યવાહીને પૂર્ણ કરાવવામાં આવે.

# ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે રાજીવ કુમાર, ૧૫ મેથી સંભાળશે પદભાર

નવી દિલ્હી

કાયદા મંત્રાલયે ૧૯૮૪ બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી છે. તે ૧૫ મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ વાતની જાણકારી કાયદા મંત્રાલયના એક પત્ર દ્વારા મળી છે. મહત્વનું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો કાર્યકાળ ૧૪ મેએ પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં રાજીવ કુમાર ૧૫ મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રાલય પ્રમાણે રાજીવ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી રહ્યા છે અને તે ૧૫ મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. દેશમાં આગામી ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે.





# મુંબઈ સામે પાંચ વિકેટથી હારતાં ચેન્નાઈ પ્લે ઓફમાંથી બહાર

સેમ્સની 16 રનમાં 3 વિકેટ : તિલક વર્માના અણનમ 34 રન: 98ના ટાર્ગેટ સામે મુંબઈનો સ્કોર 14.5 ઓવરમાં 103/5

## મુંબઈ

સેમ્સની 16 રનમાં ત્રણ અને બુમરાહે 3 ઓવરમાં માત્ર 1 રન આપતાં ઝડપેલી 1 વિકેટની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને માત્ર 10 રનમાં સમેટી લીધા બાદ પાંચ વિકેટથી મેચ જીતી લીધી હતી. જીતવા માટેના 10 રનના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈએ માત્ર 3 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તિલક વર્માએ અણનમ 34 રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી. આ પરાજયની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે ઓફમાં પ્રવેશવાની રહી-સહી આશાઓ પણ હવે સમાપ્ત થઈ ગઈ છે. મુંબઈ તો પહેલાથી જ બહાર ફેંકાઈ ચૂક્યું હતું. જીતવા માટેના 10 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા મુંબઈને મુકેશ ચૌધરીએ ફટકો પહોંચાડતા કિશન (૬)ની વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ 18 બોલમાં 10 રન કર્યા હતા, પણ તે સિમરજીતનો શિકાર બન્યો હતો. તિલક વર્માએ એક છેડો સંભાળતા શોક્રીન (10) સાથે 8 અને ડેવિડ (16\*) સાથે અણનમ 22 રન જોડતા ટીમને જીતારી હતી. અગાઉ મુંબઈએ ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટિંગમાં ઉતાર્યું હતું. ચેન્નાઈએ માત્ર 10 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મીડલ ઓર્ડરમાં ધોનીએ લડત આપતાં 33 બોલમાં અણનમ 34 રન ફટકાર્યા હતા. સેમ્સે 16 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે 3 ઓવરમાં માત્ર 1 રન આપ્યા હતા અને ઉથળાને આઉટ કર્યો હતો.



## પોઈન્ટ્સ ટેબલ

ટીમ	મેચ	જીત	હાર	પોઈન્ટ
ગુજરાત	12	6	3	12
લખનૌ	12	6	4	12
રાજસ્થાન	12	5	4	10
બેંગલુરુ	12	5	4	10
દિલ્હી	12	5	5	10
હેદરાબાદ	11	5	5	10
કોલકાતા	12	5	5	10
પંજાબ	11	5	5	10
ચેન્નાઈ	12	4	6	8
મુંબઈ	12	3	6	6

## રવીન્દ્ર જાડેજા લીગમાંથી બહાર, CSK મેનેજમેન્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અનફોલો કર્યો

મુંબઈ : આઈપીએલની 9મી સિઝન પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને સુકાની બનાવ્યો હતો પરંતુ તેના નેતૃત્વ હેઠળ ટીમ અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી. 30મી મેચે જાડેજાએ ફરીથી ધોનીને કેપ્ટનશિપ સુપરત કરી દીધી હતી. દિલ્હી સામેની મેચમાં ઈબ્રાહિમ કાચે જાડેજા રમી શક્યો નહોતો. બેંગલોર સામેની મેચ દરમિયાન કેચ ઝડપતી વખતે તે ઈબ્રાહિમ તથા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. છેલ્લા અઠવાલા મુજબ જાડેજા અને ચેન્નાઈ ટીમ મેનેજમેન્ટ વચ્ચે સંબંધો વણસ્યા હોય તેમ લાગે છે. મેનેજમેન્ટે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર જાડેજાને અનફોલો કરી દીધો છે.

## ગુજરાત ટાઈટન્સ પ્લે ઓફમાં ક્વોલિફાય, લખનઉ 82માં સમેટાતા 62 રનથી હાર્યું

ગીલના 80 બોલમાં અણનમ 53 રન બાદ રાશિદે 28 રનમાં ચાર વિકેટ ઝડપતાં ગુજરાત ટાઈટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને માત્ર 10 રનમાં સમેટી લઈને 62 રનથી હરાવ્યું હતું. આ સાથે ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં પ્લે ઓફમાં ક્વોલિફાય થનારી પહેલી ટીમ બની હતી. જીતવા માટેના 18 રનના ટાર્ગેટની સામે લખનઉની ટીમ 13.5 ઓવરમાં માત્ર 10 રનમાં જ ખખડી ગઈ હતી. લખનઉ તરફથી એકમાત્ર હૂડાએ લડત આપતાં 20 રન કર્યા હતા. હેદરાબાદના આઠ બેટ્સમેનો 5 બલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહતાં.

અમદાવાદમાં યોજાનારા આઈપીએલ-15ના સમાપન સમારંભમાં બોલીવૂડ અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ.આર. રહમાન ધૂમ મચાવશે. આઈપીએલની ફાઈનલ 29મી મે એ અમદાવાદમાં યોજાવાની છે.

## કોલકાતા નાઈટ રાઈડર્સનો 52 રનથી વિજય, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો નિષ્ફળ

વેંકટેશ-નિતિશના 83-83 રન બાદ કમિન્સ અને રસેલે 22-22 રનમાં અનુક્રમે ત્રણ અને બે વિકેટ ઝડપતાં કોલકાતાએ મુંબઈ સામેની આઈપીએલ ટી-20માં પર રનથી વિજય મેળવ્યો હતો. આ સાથે કોલકાતાએ આગેજીની આશાને જીવંત રાખી હતી. જ્યારે મુંબઈનો સતત બે વિજય બાદનો આ પરાજય હતો. અગાઉ બુમરાહે આગવી લય મેળવતા માત્ર 90 રનમાં પાંચ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઈપીએલ ટી-20માં કોલકાતાની ટીમ 6 વિકેટે 95 રન સુધી પહોંચી શકી હતી.

## સિંધુ ફરીથી ફ્લોપ, શરમજનક હાર સાથે ભારત ઉબેર કપમાંથી આઉટ

### બેંગ્લોક

બેંગ્લોક ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુના નેતૃત્વ હેઠળની ભારતીય વિમેન્સ બેડમિન્ટન ટીમ ઉબેર કપની ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડ સામે 0-3થી હારીને ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. સાતમી ક્રમાંકિત સિંધુ સતત બીજા દિવસે રિથમમાં નહોતી અને રત્નાચોક ઈન્ટાનોન સામે પ્રથમ ગેમ જીત્યા બાદ હારી ગઈ હતી. સિંધુનો 11 મિનિટ સુધી રમાયેલી મેચમાં 21-11, 19-21, 12-21થી પરાજય થયો હતો.


શ્રુતિ મિશ્રા અને સિમરન સિંઘની વિમેન્સ ડબલ્સની જોડી જાંબોલકાન

કિથિથારાકુલ અને રાવિદા પ્રાજોગજેઈ સામે 16-21, 12-21ના સ્કોરથી હારી ગઈ હતી. આ પરાજય સાથે ભારત 0-2થી પાછળ થયું હતું. વિમેન્સ સિંગલ્સના મુકાબલામાં આકર્ષી કશ્યપ પણ 8 મિનિટમાં પોર્નપાવી ચોયુવોંગ સામે 16-21, 11-21થી હારી જતાં ભારત 0-3થી હારી ગયું હતું. થાઈલેન્ડે 3-0ની અજેય લીડ મેળવી લેતાં બાકીની એક સિંગલ્સ અને એક ડબલ્સની મેચ ઔપચારિક બની ગઈ હતી જેને નહીં રમવાનો નિર્ણય લેવાયો હતો. વિમેન્સ ટીમ બુધવારે ઝૂપના છેલ્લા લીગ મુકાબલામાં સાઉથ કોરિયા સામે 4-0થી હારી ગઈ હતી.

## જુવેન્ટ્સને હરાવી ઇન્ટર મિલાન ઇટાલિયન કપમાં ચેમ્પિયન

### રોમ

એક્સ્ટ્રા ટાઈમ સુધી ખેંચાયેલી ફાઈનલમાં ઇન્ટર મિલાને જુવેન્ટ્સને 4-2ના સ્કોરથી હરાવીને ઇટાલિયન ફૂટબોલ ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું હતું. ઈવાન પેરિસિયે ઇન્ટર મિલાન તરફથી એક્સ્ટ્રા ટાઈમમાં બન્ને ગોલ કર્યા હતા. આ પહેલાં હાકેન કલહાનોગલુએ નિર્ધારિત સમયની અંતિમ પળોમાં વિવાદાસ્પદ પેનલ્ટીને ગોલમાં ફેરવીને ઇન્ટર મિલાન માટે સ્કોર સરભર કર્યો હતો. આ પહેલાં ઇન્ટર મિલાને નિકોલા બરેલાએ છઠ્ઠી મિનિટે નોંધાવેલા ગોલની મદદથી 1-0ની લીડ મેળવી હતી. એલેક્સ સેન્ડ્રોએ 10મી મિનિટે તથા



## 1.3 કરોડની કમાણી સાથે લાયોનલ મેસ્સી હાઈએસ્ટ પેઈડ એથ્લેટ, વિરાટ ૬૧મા ક્રમે

ન્યૂયોર્ક : આર્જેન્ટિનાનો ફૂટબોલ સ્ટાર લાયોનલ મેસ્સી વધુ એક વખત હાઈએસ્ટ પેઈડ એથ્લેટ બની ગયો છે. ફોર્બ્સના અનુસાર મેસ્સીએ છેલ્લા 12 મહિનામાં કુલ 1.30 મિલિયન ડોલર (લગભગ 1.3 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. 2021માં પણ મેસ્સીની કમાણી આટલી જ હતી પરંતુ તે સૌથી વધારે કમાણી કરનાર એથ્લેટ્સમાં બીજા ક્રમે હતો. 2021માં મિક્સ માર્શલ આર્ટનો રેસલર કોનર મેકગ્રિગોર સર્વાધિક કમાણી કરનાર એથ્લેટ બન્યો હતો. મેકગ્રિગોરે ગયા વર્ષે 1.10 મિલિયન ડોલર (1.1 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. બાસ્કેટબોલ સ્ટાર લેબ્રોન જેમ્સ 2022માં હાઈએસ્ટ કમાણી કરવાના મામલે બીજા ક્રમે છે. તેણે 1.2 મિલિયન ડોલર (લગભગ 1.2 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. મેસ્સીએ રમત દ્વારા 99 મિલિયન ડોલર અને 55 મિલિયન ડોલર અન્ય રીતે કમાયા છે.

### વિરાટ કોહલીની કમાણી 262 કરોડ રૂપિયા

હાઈએસ્ટ કમાણી કરનાર ટોપ-100 એથ્લેટ્સમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે અને તે કમાણીના મામલે ૬૧મા ક્રમે છે. કોહલીની સેલેરી અને વિનિંગ પ્રાઇઝનું મૂલ્ય ૨.૯ મિલિયન ડોલર આંકવામાં આવ્યું છે. જાહેરખબરોની કમાણી ઉમેરીએ તો કોહલી છેલ્લા 12 મહિનામાં કુલ 33.૯ મિલિયન ડોલર એટલે કે ૩૩.૯ કરોડ રૂપિયા કમાયો છે.

## ડેફેલિમ્પિક્સમાં ભારતીય ગોલ્ડર દીક્ષા ડાગરે ગોલ્ડ જીત્યો

### કેક્સિયાસ ડો સુલ (બ્રાઝિલ)

ભારતીય ગોલ્ડર દીક્ષા ડાગરે બ્રાઝિલના સુલ ખાતે યોજાયેલી ડેફેલિમ્પિક્સની ગોલ્ડ ઈવેન્ટની ફાઈનલમાં અમેરિકાની એશલિન ગ્રેસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મૂકબધિર ઓલિમ્પિકમાં દીક્ષાનો આ બીજો મેડલ છે. આ પહેલાં તેણે 2019માં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પ્રકારની ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર તે ભારતની પ્રથમ ગોલ્ડર બની

ગઈ છે. યુરોપિયન ટૂરમાં ભાગ લેનાર 21 વર્ષીય દીક્ષાએ વિમેન્સ ગોલ્ડ ઈવેન્ટની મેચ પ્લે કેટેગરીની ફાઈનલમાં 4-2ના સ્કોરથી વિજય મેળવ્યો હતો. ઈવેન્ટમાં ચાર હોલની ગેમ બાકી હતી ત્યારે દીક્ષાએ પાંચમા હોલ ઉપર જ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. મૂકબધિર ઓલિમ્પિકમાં 2019માં પ્રથમ વખત ગોલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દીક્ષાએ આસાનીથી ફાઈનલમાં

પ્રવેશ કર્યો હતો. જોકે અમેરિકાની યોસ્ટ કેલિને તેને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. દીક્ષાએ 2021માં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું હતું અને તે લેડીઝ યુરોપિયન ટૂર ટાઈટલ જીતી ચૂકી છે. ફ્રાન્સની માર્ગો બ્રેજોએ અત્યંત રોમાંચક મુકાબલામાં 2019ની બ્રોન્ઝ મેડાલિસ્ટ નોર્વેની આન્દ્રિયા હોલ્સટીન હેલેગર્ડને ત્રીજા પ્લે ઓફમાં હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

# કોરોનાથી ચીન બેહાલ: શાંઘાઈ-બેઈજિંગમાં દયનીય સ્થિતિ

ચીનમાં ઝીરો કોવિડ પોલિસી પર સવાલો ઉઠ્યા, ઉ. કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન લગાવાયું

## શાંઘાઈ

ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. રાજધાની બેઈજિંગ અને વ્યાપારી રાજધાની શાંઘાઈમાં પ્રતિબંધો લદાયા છે. ઘરોમાં કેદ લાખો લોકોને પણ સામાનની ડિલિવરી લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. બુધવારે મેના રોજ ચીનમાં કોરોનાના 3,475 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 357 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને 3118 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. ચીનમાં અત્યાર સુધીમાં 5191 લોકોના મોત થયા છે. આ વખતે ચીનમાં ઝીરો કોવિડ પોલિસી પર પણ સવાલો

ઉઠાવવામાં આવી રહ્યા છે. શાંઘાઈમાં દોઢ મહિનાથી લોકડાઉન લાગુ છે. ચેપને રોકવા માટે નિયંત્રણો કડક કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી. શાંઘાઈના 16 માંથી ચાર જિલ્લાના લોકોને અટવાડિયાના અંતે નોટિસ આપવામાં આવી હતી કે, તેઓ તેમના ઘર છોડી શકતા નથી. તેઓ સામાનની ડિલિવરી પણ લઈ શકતા નથી. પહેલા રહેણાંક વિસ્તારમાં ફરવાની છૂટ હતી.

શાંઘાઈમાં નવા પ્રતિબંધોનો વિરોધ વધી રહ્યો છે. કોકો વાંગ નામના રહેવાસી કહે છે કે, તે જેલ જેવું છે. અમે નીતિઓથી ડરીએ છીએ,

કોરોના વાયરસથી નહીં. બીજી તરફ, બેઈજિંગમાં અત્યાર સુધીના સૌથી કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ બેઈજિંગમાં, લોકોને તેમના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. જાહેર પરિવહન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણી ઈમારતો અને ઉદ્યાનોને પણ સીલ કરવામાં આવ્યા છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનએ પ્યોંગયાંગમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ ગુરુવારથી રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન લગાવી દેવાયું હતું



## પાકે. પીઓકેના એક હિસ્સાને ચીનને વેચી દેવાનો પ્લાન ઘડ્યો

### લાહોર

આતંકને પોષતું પાકિસ્તાન ભારતને હેરાન પરેશાન કરવા માટે નીત નવા ષડયંત્રો રચતું રહે છે. એકવાર ફરીથી તેણે ષડયંત્ર રચ્યું છે. પોતાનું કરજ ચૂકવવા માટે તેણે એક પીઓકેના એક હિસ્સાને ચીનને વેચી દેવાનો પ્લાન ઘડ્યો છે. પાકિસ્તાનની સ્થિતિ પણ કઈ સારી નથી. આર્થિક રીતે ખખડી ગયેલું પાકિસ્તાન ધીરે ધીરે શ્રીલંકા જેવી સ્થિતિ તરફ જઈ રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આવતી હુંગા ઘાટી પાકિસ્તાન ચીનને ભાડપટ્ટે આપવાની યોજના ઘડી રહ્યું છે. અહીં એકવાર સમજવા જેવી છે

કે એકવાર જો ચીન પાસે તે ગયું તો હંમેશા માટે ત્યાં ચીનનો કબજો જામી જશે. એવું પણ કહેવાય છે કે પાકિસ્તાન ચીનને ત્યાં ખનનની મંજૂરી આપવા પણ તૈયાર છે. અત્રે જણાવવાનું કે આ પહેલા આવું અગાઉ ૧૯૬૩માં બની ચૂક્યું છે. પાકિસ્તાને પીઓકેના ૫ હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી શક્તિગામ વેલી ચીનને આપી હતી જેના પર આજે પણ ચીનનો કબજો છે. હવે હુંગા ઘાટી ચીનને મળવાની ચર્ચાઓ થતા વિસ્તારમાં સ્થાનિક લોકોનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્થાનિક લોકોમાં પણ પાકિસ્તાનની સરકારની યોજનાથી નારાજગી છે.

## ઈક્વાડોરની જેલમાં બે જથ્થો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૪૪ કેદીઓનાં મોત

જેલમાંથી બંદૂકો, વિસ્ફોટકો અને અન્ય શસ્ત્રો જપ્ત, કેદીઓ પર ચાકુથી હુમલો કરાયો

### કિટો

ઈક્વાડોરની એક જેલમાં બે જથ્થો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૪૪ કેદીઓનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા એક અન્ય જેલમાં આવા જ પ્રકારની થયેલી હિંસામાં ૨૦ કેદીઓનાં મોત થયા છે.

ગૃહપ્રધાને જણાવ્યું છે હતું કે સેન્ટો ડોમિંગો સ્થિત બેલાવિસ્ટા જેલમાં કેટલાક કેદી અન્ય કેદીઓ પર હુમલો કરવાના ઈરાદાથી પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતાં. પ્રધાનના

જણાવ્યા અનુસાર જે કેદીઓના મોત થયા છે તેમના પર ચાકુથી હુમલા કરવામાં આવ્યા હતાં. મૃતકોના સંબંધીઓને મૃતદેહો પોતાના વતનમાં લઈ જવામાં મદદ કરવામાં આવશે. આ ઘટના પછી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જેલમાંથી બંદૂકો, વિસ્ફોટકો અન્ય શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલા દરમિયાન ૨૨૦ કેદી ભાગી ગયા હતાં. જેમાંથી ૧૧૨ લોકોને ફરીથી પકડી લેવામાં આવ્યા છે.



## વિશ્વની પહેલી 'બીટકોઇન સિટી'નો નકશો સામે આવ્યો



અલ સાલ્વાડોર દેશમાં વિશ્વનું પ્રથમ બીટકોઇન સિટી બનવા ૧૪૬ રહ્યું છે અને હવે અલ સાલ્વાડોરના 40 વર્ષીય યુવા રાષ્ટ્રપતિ નાથિબ બુકેલે તેમના બીટકોઇન સિટીની શરૂઆત કરી છે. બુકેલે જે મોડલનો ફોટો શેર કર્યો છે તે ગોલ્ડન કલરમાં બનાવવામાં આવ્યો છે. વિદેશી રોકાણકારોને પણ અહીં રોકાણ કરવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

## માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ કોરોના પોઝિટિવ

### વોશિંગ્ટન

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ અબજપતિ બિલ ગેટ્સ કોરોના સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે ટ્વીટ કરીને આપી છે. બિલ ગેટ્સે કોરોના પોઝિટિવ થવા પર, વેક્સિનેશન કરાવવા પર અને પોતાના ફાઉન્ડેશન વિશે જાણકારી આપી છે.

બિલ ગેટ્સે ટ્વીટ કર્યું કે, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હળવા લક્ષણો અનુભવી રહ્યો છું. હું જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હું થોડા દિવસો

માટે આઈસોલેશનમાં રહીશ. હું ડોક્ટરોની સલાહને અનુસરી રહ્યો છું. તેમણે ટ્વીટ કર્યું કે, હું ભાગ્યશાળી છું કે, મે કોરોના વેક્સિન લગાવી લીધી છે અને તેનો બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. અમારી પાસે કોરોના ટેસ્ટિંગ અને મેટિકલ હેલ્પની સારી સુવિધાઓ છે.

ગેટ્સે ટ્વીટમાં કહ્યું કે, ગેટ્સ ફાઉન્ડેશનની ટીમે 2 વર્ષ બાદ આજે પ્રથમ વખત એક સાથે એકઠા થઈ રહ્યા છે. હું ભાગ્યશાળી છું કે, મને બધાને જોવા અને તેમની કડી મહેનત માટે તેમનો આભાર વ્યક્ત કરવાની તક મળશે.

## અફઘાનિસ્તાનમાં બુરખો પહેરવાના ફરમાન સામે મહિલાઓ રસ્તા પર ઉતરી

### કાબુલ

અફઘાનિસ્તાનમાં મહિલા અધિકાર કાર્યકર કાબુલના રસ્તાઓ પર તાલિબાન દ્વારા લાવવામાં આવેલા બુરખો પહેરવાના નવા ફરમાનનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી છે. તાલિબાનના ફરમાન હેઠળ મહિલાઓએ સાર્વજનિક સ્થળોએ બુરખો પહેરવો ફરજિયાત છે. આ ફરમાનનો વિરોધ કરતા કાર્યકરોને પણ તાલિબાન ધમકાવવા પર ઉતરી આવ્યું છે. ધમકી છતાં પણ મહિલાઓએ રાજધાનીના માર્ગો પર ફૂટ કરી હતી અને આ ફરમાનની સામે ન્યાયની માંગ કરી હતી. પ્રદર્શન કરી રહેલી મહિલાએ જણાવ્યું હતું કે અમારે તાલિબાનના કઠોર વ્યવહારના સામનો કરવો પડી રહ્યો છે.

## 15 લાખથી વધુ પરિવારો પર ભૂખમરીનો તોડાતો ખતરો યુકેમાં મંદીનો પગપેસારો, કુગાવો 30 વર્ષની ટોચ ઉપર પહોંચી ગયો

### યુકે

રશિયા અને યુકેન મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને કારણે ફૂડ ઓઈલની કિંમત ટોચ પર પહોંચી ગઈ છે. જેના કારણે ઘણા દેશોમાં મોંઘવારીએ ઘણા દશકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

યુકેમાં કુગાવો 30 વર્ષની ટોચે પહોંચી ગયો છે. જેના કારણે લોકોને 2 ટંકની રોટી મેળવવા પણ મુશ્કેલીઓ પડી રહી છે. એક નવા સંશોધન મુજબ, આગામી એક વર્ષમાં લગભગ 15 લાખ પરિવારો

ખાવા-પીવા અને ઊર્જાના બિલ ચૂકવવાની સ્થિતિમાં નહીં હોય. મોંઘવારી અને ભારે ટેકસે અહીના પરિવારોનું બજેટ બગાડ્યું છે. નાણા મંત્રાલયનું કહેવું છે કે, સરકાર લોકોને દરેક સંભવ મદદ કરી રહી છે. NIESRએ યુકેની અર્થવ્યવસ્થા પરના તેના તાજેતરના ત્રિમાસિક અંદાજમાં જણાવ્યું છે કે, ગરીબ પરિવારો કુગાવાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે, કુગાવો થોડા મહિનામાં 10 % સુધી પહોંચી શકે છે.

## ચીન સાથે મહાયુદ્ધ માટે જાપાન તાઈવાનને સંપૂર્ણ સાથ આપવા તત્પર થયું

### ટોક્યો

પૂર્વ ચીન સમુદ્રમાં સશસ્ત્ર સંઘર્ષ માટે જાપાન કમર કસી રહ્યું છે. એક મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાપાન તેટલા માટે તેની 'તૈયારીઓ' કરી રહ્યું છે કે યુકેન ઉપરનાં રશિયાનાં આક્રમણ પછી ચીન તેવાન ઉપર આક્રમણ કરે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. સિંગાપુર પોસ્ટે જણાવ્યું છે કે, સોલોમન દ્વિપ સમુદ્ર સાથે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી ચીન હવે પ્રશાંત ક્ષેત્રમાં તેની ગતિવિધિ વધારી રહ્યું છે. આ કારણોને લીધે ઓસ્ટ્રેલિયાના સમુદ્ર તટથી ૨૦૦૦ કી.મી.થી પણ ઓછા અંતરે રહેલા ટાપુ ઉપર ચીનનો નૌ-સેના-મથક સ્થાપવાની પણ મંજૂરી આ કરારોમાં આવરી લેવામાં આવી હશે.



# શ્રીલંકામાં લોહિયાળ દેખાવો: દેખો ત્યાં ઠારના આદેશ

<p>ભૂતપૂર્વ પીએમ મહિન્દા રાજાપક્ષેએ પરિવાર સાથે નેવલ બેઝમાં શરણ લીધી ત્રિંકોમાલી નેવલ બેઝ સામે દેખાવો શરૂ</p>	<p>હિંસક દેખાવોમાં મૃત્યુઆંક આઠ થયો, ગોટબાયા રાજાપક્ષેને તુરંત સંસદ બોલાવવા માટે અધ્યક્ષનો આગ્રહ</p>	<p>સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજધાની કોલંબોને આર્મીને હવાલે કરી દેવાયું અને દેશવ્યાપી કરફ્યૂ લાદવામાં આવ્યો</p>
---	--	--

**કોલંબો** અભૂતપૂર્વ આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદલી બદલતર થઈ રહી છે. સરકાર વિરુદ્ધ લોકોમાં આક્રોશ એટલો બધો વધી ગયો છે કે મહિન્દા રાજાપક્ષેએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવા છતાં દેખાવકારો દ્વારા હિંસક દેખાવો થઈ રહ્યા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજધાની કોલંબોને આર્મીને હવાલે કરી દેવાયું અને દેશવ્યાપી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આવા સંરક્ષણ મંત્રાલયે દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો છે. વધુમાં કરફ્યૂ ૧૨મી સુધી લંબાવાયો છે. બીજાબાજુ વડાપ્રધાન મહિન્દા રાજાપક્ષેએ પરિવાર સાથે કોલંબો છોડીને ભાગવું પડ્યું છે. અસાધારણ આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરતા શ્રીલંકાના અનેક શહેરોમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. પરિણામે સૈન્યને દેખાવકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. બીજાબાજુ વિપક્ષે દેશમાં સરકાર વિરોધી શાંતિપૂર્ણ દેખાવોને હિંસક બનાવવા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજાપક્ષેની ધરપકડ કરવાની માગણી કરી છે. આખા શ્રીલંકામાં ચાર દિવસ પહેલા જ ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ હતી. તેમ છતાં સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતાં સોમવારે દેશવ્યાપી કરફ્યૂ લાગુ કરાયો હતો. બીજાબાજુ હાલ સરકાર વિનાના શ્રીલંકામાં અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્ધનેએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્ષેને તુરંત સંસદ બોલાવવા આગ્રહ કર્યો છે. ડોલરની અછત અને મોંઘવારી, ઈંધણ અને ગેસની અછત તથા કલાકો સુધી વીજકાપનો સામનો કરતાં લોકો ૩૧ માર્ચેથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારના વિરોધમાં દેખાવો શરૂ કર્યા હતા.

## 300 અબજ રૂપિયા નહીં ચૂકવો તો બત્તી ગુલ કરી દેશું : ચીની કંપનીઓની પાક.ને ધમકી

ઈસ્લામાબાદ : આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના 'જીગર-જાન દોસ્ત' ચીન જ બહુ મોટો ફટકો આપે તેમ છે. ચીનની વીજ-ઉત્પાદક કંપનીઓએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે. ૩૦૦ અબજ રૂપિયા નહીં ચૂકવાય તો તેઓ પાકિસ્તાનની બત્તી ગુલ કરી દેશે. પાક. માં કાર્યરત બે ડઝનથી વધુ ચીની કંપનીઓએ કહ્યું છે કે, જો આ મહિને તેમના બાકી રહેલા ૩૦૦ અબજ રૂપિયા ન ચૂકવાય તો તેઓ વિદ્યુત-ઉત્પાદન કેન્દ્રો બંધ કરી દેશે. ચીનની ૩૦ કંપનીઓ અત્યારે 'ચાયના - પાકિસ્તાન-ઈકોનોમિક-કોરીડોર' નીચે પાકિસ્તાનમાં કાર્યરત છે. તેઓ પાકિસ્તાનમાં ઊર્જા, સંચાર અને રેલ્વે સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરે છે.

## યુકેન પર ન્યુક્લિયર એટેકનો ઈરાદો નથી, આક્ષેપો પાયાવિહોણા : રશિયન પ્રવક્તા

મોસ્કો : યુકેન પરના રશિયાના હુમલાના ૭૨મા દિવસે રશિયાએ સ્પષ્ટ કર્યું કે, તે યુકેન પર પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાનો કોઈ ઈરાદો નથી. પરમાણુ શસ્ત્રનો ઉપયોગ થવો જ ન જોઈએ. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલેક્સી જૈનસેમે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોએ મુકેલા આક્ષેપો પાયાવિહોણા છે. તે યુકેનને ઉશ્કેરવા માટે જ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહી કરવાના સિદ્ધાંતનું પાલન કરે છે. આ પ્રકારના હુમલામાં કોઈ દેશ વિજેતા હોતો જ નથી. અમેરિકા ઉપર નિશાન નોંધતા જૈનસેમે કહ્યું કે, અમેરિકા સ્થિત રશિયન રાજદૂત એનેનોલી એંતેનોવેના કથને મરડી મચડી રજૂ કરવામાં આવ્યું છે.

|| શ્રી સ્વામિનારાયણો વિજયતે તમામ ||

# કાલે કે હમણાં નહીં જેવા શબ્દો સપનાની હત્યા કરનારા

‘યોગાસન પ્રાણાયામ કરવા તો છે, પણ થોડી જવાબદારીઓ હળવી થાય પછી.’ ‘આ વખતે પરિક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરવી છે પણ આવતીકાલથી શરૂઆત કરીએ.’ ‘મારે મારી ભૂલોની કબૂલાત તો કરવી છે, પણ યોગ્ય સમય આવે ત્યારે.’ ભગવાનનીએ કૃપા છે કે, માનવમાત્રને શુભપ્રેરણાઓની અંતઃસ્ફૂરણા થતી રહે છે. પણ મનુષ્યની ‘કાર્યને ઠેલવાની’ વૃત્તિ એ શુભ સંકલ્પોના ‘પાળિયા’ બનાવી દે છે. વિશ્વમાં દરરોજ અબજો માણસોને રચનાત્મક અને ક્રાંતિકારી વિચારોની પ્રેરણાથી થતી હશે, પરંતુ ‘કાલે’, ‘હમણાં નહીં’, ‘પછી કરીશું’ જેવા ઘાતક શબ્દો (શસ્ત્રો!) એ ભવ્ય સ્વપ્નાઓની હત્યા કરી નાંખે છે. અને તે અસાધારણ વિચારોને મનમાં અને મનમાં સંગ્રહી લોકો સાધારણ વ્યક્તિ તરીકે આ પૃથ્વી પરથી વિદાય થઈ જાય છે. પ્રસિધ્ધ ચિંતક ગેટેએ કહ્યું છે “ What you can do, or dream you can do, begin it, Boldness has

genius, Power and magic in it. Only engage and then the mind grows heated - Begin it and the work will be completed ” જે તમે કરી શકો છો, અથવા જે કરવા માટે તમે સ્વપ્ન સેવો છો તેની શરૂઆત કરી દો. સાહસમાં એક શક્તિ છે, જાદુ છે, પ્રતિભા છે. મગજને એક ધક્કો મળશે પછી કાર્ય એની જાતે સંપન્ન થવા માંડશે.” બસ જરૂર છે ઠેલવાની વૃત્તિને ચિર-વિદાય આપવાની અને શરૂઆત કરવાના ‘સાહસ’ની. ‘પછી કરીશું’માં વિલંબ છે, અનિશ્ચિતતા છે, દુવિધા છે, અવિશ્વાસ છે. જ્યારે ‘આજે’ અને ‘અત્યારે’ માં નક્કરતા છે, તરવરાટ છે, આશા છે, ઉત્સાહ છે, શૌર્ય છે. ‘કાલે’ માં વૃધ્ધત્વ છે ‘આજે’ માં યૌવન છે. ‘આજે અને અત્યારે’નો મંત્ર અકલ્પનીય ચમત્કારો સર્જી શકે છે. શું કોઈ કલ્પના કરી શકે કે, ગુજરાતના અંતરિયાળ ગામડાનો છોકરો ગિનિસ

વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રકાશિત થયેલ The most influential Personality of the millanum.- છેલ્લા ૧૦૦૦ વર્ષના સૌથી પ્રતિભાશાળી ૨૦ વ્યક્તિઓની યાદીમાં સ્થાન ધરાવતો હોય? શું કોઈ કલ્પના કરી શકે માત્ર ૭ ધોરણ ભણેલ એક ખેડૂતપુત્ર બિરુદથી સન્માને? આવા તો અનેક આશ્ચર્યોની હારમાળા વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં રચાઈ છે. ૮૫ વર્ષના જીવનકાળ દરમિયાન સેંકડો વર્ષોનું કાર્ય કરનાર પ્રમુખસ્વામી મહારાજની અદ્વિતિય સિધ્ધિઓથી વિશ્વ અચંબિત છે. પરંતુ આ જવલંત લાખથી વધુ પત્રોને વાંચીને તેનો પ્રત્યુત્તર આપનાર તેઓના જીવનમાં કેવી કાર્ય પ્રતિબદ્ધતા હશે ! એક વખત પત્રોની એક થપ્પીના જવાબો પૂર્ણ થયા બાદ તેઓ પેનનું ઢાંકણ બંધ કરી નીચે મુકવા જતા હતા, ત્યાં જ સેવક સંતે બીજી થપ્પી તેઓના હાથમાં આપી, પેનનું ઢાંકણ ખોલી તેઓએ ફરી લખવાનું શરૂ કર્યું. ત્યાં ઉપસ્થિત એક સંતે કહ્યું “ સ્વામી ! હમણાં રહેવા દો ને? થોડો આરામ કરો પછી પત્રોના જવાબ આપજો” ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પ્રત્યુત્તર વાળ્યો “ પત્ર લખનાર કાગડોળે જવાબની રાહ જોતા હોય અને આપણે બેસી રહીએ કેમ ચાલે? આમ પણ અત્યારે આ થપ્પીનો જવાબ નહીં આપું તો આવતીકાલે બીજા નવા કાગળ ઉમેરાશે. એટલે આ થપ્પી વધુ મોટી થશે. માટે આજનું કામ આજે જ કરી લેવું સારું.” પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં કોઈ ઝાકઝમાળ કે છાકમછોળ નથી. પણ શ્રેષ્ઠ જીવન જીવવાની સહજ અને નક્કર શૈલી છે. ‘આજનું કામ આજે જ કરી લેવું’- સહજ,



સફળતા પાછળના અનેક કારણોમાંનું એક કારણ છે એમના જીવનકોષમાં ‘ચાલે’ અને ‘કાલે’ જેવા ઘાતક શબ્દોને સ્થાન જ ન હતું. તેઓ ‘આજનું કામ આજે કરીએ’ એ મંત્રને વરેલાં હતાં. સાડા સાત

સરળ અને સચોટ અનુભવામૃત. તેઓ કહેતાં “અત્યારે જે કામ કરવાનું હોય તે એક સેકન્ડ પછી કરવાનો વિચાર આવે તે પણ આળસ છે. આ જ ખાસિયત છે મહાનપુરુષોની. સરેરાશ માણસો દિવસો અને કલાકના પરિમાણમાં જીવતા હોય છે, જ્યારે દિગ્ગજ વ્યક્તિઓ મિનિટો અને સેકન્ડોના પરિમાણમાં જીવે છે. એટલે જ ‘કાલે’, ‘ચાલે’ કે ‘પછી કરીશું’ જેવા શબ્દો તેમને અભડાવી શકતા નથી. યાદ રહે કે, કાલ ઉપર આપણો કોઈ અધિકાર નથી. આપણા હાથમાં વર્તમાન છે. ‘કાલ’ના વાયદા છોડી ‘આજે’ અને ‘અત્યારે’માં જીવનને ભરીએ. એક ચાઈનીઝ કહેવત છે “છોડ તો આવતીકાલે બીજા નવા વાવવાનો ઉત્તમ સમય ૨૦ વર્ષ પહેલાનો હતો. બીજો ઉત્તમ સમય અત્યારે જ છે.” અર્થ એ છે કે, કોઈપણ કામને ઠેલ્યા વગર સત્વરે કરવાની વૃત્તિ રાખીએ. અને એક સત્ય સતત નજર સમક્ષ રાખીએ. ‘It’s Now or Never’- ‘અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં.’



# HONEST - DEDICATED - TEAMWORK

*Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.*



## CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



Look No Further, A Beautiful Raised Bungalow, Ready To Move In. Finished Basement With 2 Bedrooms. Centrally Located To All Of Belleville's Local Amenities. Close To Wellness Centre, Mall, Transit, Parks & 401-Home Is Perfect For Those On The Go! Access To The Fenced Backyard And Potential For In-Law Suite With A Separate Walk-Up Basement Entrance.



A Beautiful Raised-Bungalow Perfect For A Growing Family. Functional Layout With 3 Bedrooms On The Main Floor, 2 In The Basement. The Floorplan Allows For An In-Law Suite On The Lower Level With Kitchen Providing Income Potential! Bright And Spacious W/Ample Windows Providing Natural Light. Great Curb Appeal. Walkout From The Kitchen To A Large Deck Overlooking The Private Backyard. Minutes To Belleville Go Station, Hwy 401 And Much More.

- No Pressure
- No Obligation
- Just Answers to Your Questions... Its that Simple!

Call or DM for further details on this both amazing projects.

*You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.*

**Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !**

## Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative

[teamkharodia@gmail.com](mailto:teamkharodia@gmail.com)

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F : (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



## MOTEL for SALE

### NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: [ncpancholi@gmail.com](mailto:ncpancholi@gmail.com)

Website: <https://niraj-pancholi.c21.ca/>

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience  
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...  
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

**Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011**  
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



## MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence

Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021

### NEW: 31 ROOM MOTEL IN SAULT STE. MARIE

With 3 BR house, main street of downtown, minutes away from all amenities such as shopping malls, schools, college, hospital, airport etc. & Close to USA border.

Asking Price: \$1.7M

(about 40% to 45% down payment required)

### URGENT LISTINGS REQUIRED MOTELS & HOTELS

Small Motels to Franchise Hotels anywhere in Ontario  
Qualified Buyers are ready to close in 1 to 2 months

### 12 TO 45 ROOM MOTEL IN NORTHERN ONTARIO

Asking Price: \$900,000 To \$5,000,000  
(40% to 50% down payment required)

### MOTEL OPERATOR / WORKING PARTNER REQUIRED

Good Salary + Partnership (20% to 50%)  
Minimum \$200,000 investment required

### RECENTLY SOLD MOTELS NEAR.....

Blind River, Welland, London, Sarnia, North Bay,  
Cochrane, Pembroke, Ottawa, Thunder Bay

### JOB AVAILABLE: For the Motel located in Northern Ontario

- Housekeeper for room cleaning and general work in the motel, accommodation available for the couple / small family
- Working Partner Willing to invest min \$200K, stay & operate/manage the motel offering Partnership + Salary to operate